

# બયઅતનામું

આ બયઅત નામાના વિષયથી મુરાફ તે અહુદનામું-કરાર છે જે લેખિત રીતે મોજુદ છે. જેની કલમો અને શરતોની હેઠળ જમીન અને શહેરોના વલી અસ, (આપણી રૂહો ફીદા થાય,) આપના વ્યવસ્થાપકો અને સાચીદારો, દોસ્તો અને હમસ્કર અને આપની તમામ પ્રજા, વાયદા અને વચનને પૂરું કરવાની કસમ ખાશો. પરંતુ તેની પહેલા કે આ અહુદનામાની અમુક વ્યક્તિઓની ચર્ચા કરું, જરૂરી છે કે બયઅત શબ્દનો સંદર્ભ, “બયઅત” કોને કહે છે, બયઅતનો અર્થ શું છે ? ઈસ્લામની પહેલા આ શબ્દ કયારે અને ક્યાં વાપરવામાં આવતો હતો ? ઈસ્લામના સૂર્યના ઉદ્ય પહેલાં આ શબ્દને શું ઐતિહાસિક મહત્વ મળ્યું, આ શબ્દ ક્યાં સુધી રાજ્ય સરકારના નિયમની હયસીયતથી ચાલુ રહ્યો, પછી તે સર્વ સામાન્ય રીતે અમલમાં આવ્યો કે ધીરે ધીરે આ શબ્દ સમેટાઈને પોતાના રક્ષણામાં આવી ગયો, જેથી તે ગસબ કરનાર બાતીલ હુક્મતની જબરદસ્તીથી સુરક્ષિત રહી શકે, તેનો ખૂબજ ટૂંકો અભ્યાસ કરી લઈએ.

બયઅતનો શબ્દકોષનો અર્થ વાયદો અને વચન છે. ઈજને ખલદુને પોતાની પ્રસ્તાવનામાં લખ્યું છે :

كَانُوا إِذَا بَاِيْعَ الْأَمِيرَ جَعْلَ أَيْدِيهِمْ فِي يَدِهِ تَاكِيدًا فَاسْبَهُ

ذالك فعل البايع و المشترى

(તફસીરે નમુના ૨૨/૭૦ ઈજને ખલદુને મુકદમામાં નકલ  
કર્યા મુજબ પા. ૧૭૪)

જ્યારે કોઈ હકીમની બયઅત કરતા હતા ત્યારે તાકીદ માટે હાથ ઉપર હાથ રાખતા હતા. આ કામ ખરીદ-વેચાણ જેવું હતું.

બયઅત એટલે વાયદો અને વચન. (અલ-મુન્જુદ ઉર્ડુ). ગયાસુલ લોગાતમાં તેની વધુ વિગત આપી છે. એટલે દોસ્તીમાં નિખાલસતા, વફાદારી અને તાબેદારી હોવી.

ઈસ્લામના ઉદ્યમાં બયઅત શબ્દનો હુજના મોકા ઉપર તે સમયે ઉપરોગમાં લીધો, જ્યારે અકબાના સ્થળે (જે તાએકમાં છે) ૧૨ માણસો જે બની ખરજથી સંબંધ ધરાવતા હતા, તેઓ મદીનાથી આવ્યા અને તે લોકોએ રસૂલે ખુદા સ.ના હાથો ઉપર બયઅત કરી જેને ઈતિહાસમાં બયઅતે ઉલા (પહેલી બયઅત) કહેવામાં આવે છે. એ માટે કે તે પછી મદીનાથી ૭૩ માણસોનો કાફલો આવ્યો છે અને તે લોકોએ જનાબ રિસાલતે માબાબ સ.ના હાથ ઉપર અકબામાં જ બયઅત કરી છે. જેને બીજુ બયઅત કહે છે. ઈસ્લામના બીજા મહત્વના વાણાંક ઉપર “બયઅતે રિજવાન” છે. આ તે મહત્વની ઐતિહાસિક બયઅત છે જેની ચર્ચા કુરાને મજુદમાં કરવામાં આવી છે.

“બસ ખુદા રાજ થાય તે મોઅમ્રીનો ઉપર જેમણે ઝડની નીચે

(પયગમભરે ઈસ્લામના હાથ ઉપર) બયઅત કરી.”

(સુરા ફત્હ ૧૮)

આ પ્રસંગ હિજરતના છહા વરસે બન્યો જે સમયે રસૂલે અકરમ (સ.) હજ માટે તશરીફ લઈ ગયા. આપે ઉસ્માન બીન અફફાનને પોતાના પ્રતિનિધિ બનાવીને મકા મોકલ્યા. અને એવી અફવા ફેલાઈ કે ઉસ્માન બીન અફફાનને કંલ કરી દેવામાં આવ્યા. જેથી રસૂલે ખુદા (સ.) એ મોઅમ્રીનોને બોલાવ્યા અને એક ઝડ નીચે વચન અને વાયદો લીધો કે આપણે ત્યાં સુધી કાફીરો સાથે લાઈ કરતા રહીયાં, જ્યાં સુધી જાનમાં જાન બાડી છે અને મેદાન છોડીને ભાગી નહિ જઈએ. આ બયઅતને ‘બયઅતે રિજવાન’ કહે છે. જ્યારે આ ખબર મકાવાળાઓને પહુંચ્યો તો હલચલ મચ્યો ગઈ. જેના પરિણામે સુલેહ હોઢયબીયાનો અમલ જાહેર થયો અને અમલમાં આવ્યો.

સ્વીઓની બયઅત :

ત્રીજી મહત્વની બયઅત જે અહિ નોંધ કરવાને પાત્ર છે તે સ્વીઓની બયઅતની છે.

કુરાને મજુદના સુરા મુભતહેનાની ૧૨મી આયત જે ફત્હે મકા પછી ઉત્તરી.

بِإِيمَنِهِ النَّبِيُّ إِذَا جَاءَكَ الْمُؤْمِنَاتُ يُبَأِيْنَكَ عَلَىٰ أَنْ لَا يُشْرِكُنَ بِاللَّهِ شَيْئًا وَ لَا يَسْرِقْنَ وَ لَا يَقْتُلْنَ أَوْ لَا يَدْهُنْ وَ لَا يَأْتِيْنَ بِبُهْتَانٍ يُفْتَرِنَهُ بَيْنَ أَيْدِيهِنَ وَ لَا جُلْهُنَ وَ لَا يَعْصِيْنَ فِي مَعْرُوفٍ فَبَيْعُهُنَ وَ اسْتَغْفِرُ لَهُنَ اللَّهُ، إِنَّ اللَّهَ عَفُورٌ رَّحِيمٌ

હે નભી, જ્યારે ઈમાન લાવનારી સ્વીઓ તારી પાસે એવી શરતે બયઅત કરવા આવે કે તેણીઓ,

(૧) ન કોઈ વસ્તુને અલાહની શરીક બનાવશો, (૨) અને ન ચોરી કરશો (૩) અને ન વ્યાલિયાર કરશો (૪) અને ન પોતાના ઓલાદને મારી નાખશો. (૫) અને ન પોતાના હાથ અને પગ વચ્ચે (અર્થાત પોતાના મનમાંથી ઉપજાવી કાઢેલું) આળ ચડાવશો. (૬) અને ન કોઈ વ્યાજબી કાર્યમાં તારી નાફરમાની કરશો તો તેમની બયઅત સિવકારી લે, અને તેમના સંબંધમાં અલાહ પાસે ક્ષમા માગ, નિઃસંદેહ મોટો ક્ષમાવાન (અને) દયાવાન છે. (આ આયતની નીચે અલામા ઝીશાન હુયદર જવાઈ, (તાબ સરાહ)નો હાશીયો, જે આપે કુરાનના તરજુમામાં નકલ કર્યો છે વાંચકો તે ઈશારાઓનો અભ્યાસ કરે.)

કુરાને મજુદમાં નોંધપાત્ર બે બયઅતનામાઓના નમુના જે રિસાલત માબાબ (સ.)ના રિસાલતના હોદાના અનુસંધાનમાં

જોવામાં આવ્યા તેનાથી સંબંધ અને સંદર્ભ ઉપર પાણ પ્રકાશ પેઢે. પુરુષો પાસે બયાત લેતી વખતે અડગ રહેવા અને છટકી ન જવાનો વાયરો અને વચ્ચે છે. માત્ર ગ્રાણ વરસ પહેલા ઓહદની લડાઈમાં આ દ્રશ્ય સામે આવી ચુક્કયું હતું. કુરઆને મજૂદે અડગ રહેવા માટે અનેક વખત વારંવાર તાકીદ કરી છે : (સાબિત કદમ રહો, સભર કરો, જેહાણ કરો, અલ્લાહથી ડરો અને તેમાં જ તમારા લોકોની સફળતા છે.) આયતનો સાબિત થએલો મુદ્દો એટલે કે ખુદાના હુકમો ઉપર અમલ અને (બીજુ આયતમાં) નાજાએઝ કામો ન કરવાની તાકીદ ઉપર ભાર આપી રહ્યા છે. પુરુષોમાં છટકી જવાનો મૂળ સ્વભાવ જલ્દી પેદા થઈ છે. તેથી મજબુતીથી પગ મૂકવાની તાકીદ કરવામાં આવી છે. મરુસલે અન્યજમની રેહલત પછી તલવાર અને કલમે વિચારો અને દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવવા માટે બેફામ અને બેધડક નાસ-ભાગ કરી છે. એટલે સુધી કે કરબલાની મહાન ઘણના બની. ઈમામ અસ્ (અજ.) એ ફરમાયું :

سلام من لو كان معك بالطفوف لو قالك بنفسه حدّ  
السيوف

‘જો આપની સાથે કરબલામાં હતે તો જાનની બાજુ લગાડીને  
તલવારોથી આપનું રક્ષણ કરતે.’

મકાના વિજય પછી રિસાલત મઆબ સ.એ સ્વીઓ પાસે  
બયઅત અને પાંચ નાજાઓઝ કામો તરફ ધ્યાન દોર્યું. થોડી  
અભ્યાસપૂર્ણ દ્રષ્ટિથી અલ-મુન્તજરના મોહર્રમુલ હરામના  
૧૪૨૨ હિજરીના “આલે જીયાદ કોણ ?”ના શિર્ષક હેઠળનો  
લેખ વાંચશો. જેમાં આ વિષય ઉપરની કાર્યવાહીની એક જલક  
જોવા મળે છે. એટલે કે અરબ સ્વીકોમાં થોડી ચારિત્યવાન ઉપરાંત  
તેમાં દશવિલી ચારિત્યહીન સ્વીઓ પણ હતી. તેથી તેઓની ઉપર  
મનાઈના હુકમોની શરતો પણ લાગુ કરવામાં આવી હતી.

બીજો સમયગાળો મવલાએ કાએનાત અલ્લી  
અલયહિસ્સલામનો છે. ઉસ્માનના કટલ પછી હજરતના દરવાજા  
ઉપર મદ્દીના વાસીઓ અને આજુભાજુના લોકોની લીડ જામી.  
અને સૌથે ઈમામ અલ્લી અલયહિસ્સલામાની સંપૂર્ણ તાબેદારીનો  
વાયદો કર્યો અને હજરતના હાથ ઉપર બિનશરતી પોતાની બયઅત  
કરી. તે પછી આપે લોકોને કહ્યું, “એક તો મારો તમારો ઉપર હક છે  
અને એક તમારો મારી ઉપર હક છે કે હું તમારી ભલાઈ નજર સમક્ષ  
રાખ્યું અને બયતુલ મલામાંથી તમને પૂરેપૂરો હક આપી દઉં. અને  
તમને શિક્ષાણ આપું કે તમે અજ્ઞાન ન રહો અને તેવીજ રીતે તમને  
સારા સંસ્કારો શીખવાનું જેના ઉપર તમે અમલ કરો.... અને તમારા  
ઉપર મારો હક છે કે તમે બયઅતા (ની જવાબદારીઓ)ને પૂરી કરો  
અને સામે અને પાછળથી ભલાઈ કરો. જ્યારે બોલાવું ત્યારે મારા  
અવાજ ઉપર લબ્ધયક કહો અને જ્યારે કોઈ હુકમ આપું ત્યારે તેને  
બજાવી લાવો.” (નહુજુલ ભલાગાહ સુખી સાલેહ ખુલ્લો ૩૪)

ત્રીજો સમયગાળો એ છે કે જ્યારે ઈમામ હસન અલયહિસ્સલામ થોડા લોકો સાથે બેઠા હતા કે શામનો અમીર દાખલ થયો. થોડા લોકોએ તેના હુથ ઉપર બયઅત કરી ત્યારે

ઈમામ અલયહિસ્સલામે ફરમાવ્યું :

أَلَا تَعْلَمُونَ إِنّي أَمَّا مَكُمْ مُفْتَرِضٌ الطَّاغِيَةُ عَلَيْكُمْ

“શું તમે નથી જાણતા કે યક્કિનથી હું તમારો ઈમામ છું. તમારી ઉપર મારી તાબેદારી વાળું છે.” (એટલે બયઅત ઈસ્લામનો પાયાનો નિયમ છે. જેની તાબેદારી તમારા ઉપર વાળું છે. તેને છોડીને બીજાની બયઅત કરો છો.) (કમાલુદીન ૧/૩૧૬ પ્રકરણ ૨૮, ભાગ ૨)

ચોથો પ્રસંગ ઈમામ હુસ્યન અલયહિસલામના જમાનાનો છે. જ્યારે યદીઓ ગાડી ઉપર આવ્યો અને મદ્દીનાના હાકીમને પત્ર લખ્યો કે રસૂલ સ.ના ફરગન્દ હુસ્યન (અ.) પાસે બધતાની માગાણી કરો. અથવા તેમનું માથું કાપી નાખો અને મને મોકલી આપો. વલીઓ બીજું ઉત્થાએ હજરતને દાડુલ અમારામાં બોલાવીને બયાનત અંગે કહ્યું તારે આપે ફરમાવ્યું : “હું નબીનો અહુલેભયત છું, રિસાલતના ઈલમનો ખજાનો છું. મલાએકાઓના આવવા જવાનું સ્થાન છું અને રહેમતનું કેન્દ્ર છું. એ અમીર ! યદીઓ શરાબ પીનારો છે. સંમાનીય માણસોને કટલ કરે છે અને જાહેરમાં ગુનાહનું આચરણ કરે છે.”

مُثْلِي لَا يَأْتِي مُثْلُه

મારા જેવો તેના જેવાના હાથ ઉપર બયાત નહિ કરે. (અલ-મુન્તાજી ઇ. ૧૪૨૨ મોહર્રમ અંક) અહીંથી આશરે છ મહિનામાં કરબલાની મહિનાન ઘટના બની.

જ્યારે બયઅતની પવિત્રતા અને તેની ભવ્યતાને દબાણપૂર્વક  
મેળવવાનું શરૂ થયું, અને સૌથી વધુ નજીસ રજકર્તાઓ અલ્પાહના  
ખાસ બંદાળો પાસે બયઅતની માંગણી કરવા લાગ્યા ત્યારે જાણે  
કે ઈસ્લામની આબરૂ ઉપર આફત આવી પડી. યઝીદના ગાદીવારસ  
થતાં પહેલા મોગીરાએ ૪૦ વ્યક્તિઓને કુફાથી મોઆવીયા પાસે  
મોકલ્યા. એ લોકોએ યઝીદના હાથ ઉપર બયઅત કરી, યઝીદ તે  
લોકોના આગેવાનને ખુણામાં લઈ જઈને પૂછ્યું : મુગીરાએ તમારું  
ઈમાન કેટલામાં ખરીદ્યું. તેણે જવાબ આપ્યો ૪૦૦ દિરહમમાં.  
(અલ મુન્તાર મોહર્રમ લિ. ૧૪૨૨)

બયાત એટલે કોલ-કરાર અને વફાદારી, વાયદો અને વચ્ચન, પવિત્રતા અને સ્વચ્છતા. આ બધું રાજકર્તાઓના દગ્ગા ફિટકાથી નાશ થવા લાગ્યું. દીસ્લામની રૂહ જાડો કે બયાતના મેદાનમાં પોતાનું મુળ સ્થાન અને ઉચ્ચતા શોધી રહી હતી ત્યાં તો સચ્ચદુષ શોદું. દીમામ હુસ્યન અલયહિસ્સલામનો અવાજ મદીનાથી બુલંદ થયો. મણી લા પાયાં મણી અને સમગ્ર જગત ઉપર છવાઈ ગયો. હિ.સન ૬૧નું નવું વરસ સાક્ષી છે કે પછી બયાત ઝુલમ અને ખૂબ નીચતાભર્યા રાજકર્તાઓના દસ્તૂરથી ઘણી ઉચ્ચ બની ગઈ. અંતે તેના અંતિમ સૌથી વધુ સુરક્ષિત સ્થાનમાં સ્થાઈ બની ગઈ. આ એક હુકીકત છે કે હજરત હુક્કત (અલયહિસ્સલામ) સામે આવશે અને ઝુહુરના સમયે બયાતનું પુનરાવર્તન થશે. જ્યારે તેનો નકશો કિતાબોમાં સિલસિલાબંધ જોવામાં આવે છે ત્યારે ક્યારેક

એવું લાગે છે કે કોઈ સોનેરી સ્વખું જોઈ રહ્યો હોય. અને હદ્ય ખુશીથી પુલિકિત થઈ જાય છે. પછી જાણે સ્વખાના મોજુદ રહેલા તારો વિભરાઈ જાય છે. પોતાના મુલ્ય વગરના કાળી યાદીવાળા આમાલનામા વચ્ચેથી કણસતા હિબકાઓ લેતો રૂહનો અવાજ સંભળાય છે. પછી બયથી સમગ્ર શરીર ધુજુ ઉડે છે. ક્યારેક એવું લાગે છે કે કોઈ જાણીતો ચહેરો દેખાઈ ગયો છે. જે કુફની ચાર દિવાલોમાં શહાદતના સમયે કોઈના જબું થવાથી આંસુ વહાવી રહ્યો છે. આ બધી હકીકિત જાણ્યા પછી પણ અસરના ધગધગતા વાતાવરણમાં “હુલમીન નાસેરીન....” ના અવાજ ઉપર લખબયક કહીને દોડવાને બદલે કોઈ નિરાશાની સાથે અર્થઘટનની પરેશાનીઓની સાંકળોથી બંધાઈને રહી ગઈ હોય. આ મારા આત્માનો પોતાનો અવાજ હતો. જે ઠંડા નિશ્ચાસનો સહારો લઈને જીબ ઉપર અદા થઈ ગયો.

એટલા માટે કે આજે કરબલાની કરુણ ઘટના પસાર થયાની ૧૪ સંદીઓ પસાર થઈ ગઈ. એટલે સુધીકે ગયબતે સુગરા આવી. અને મુશ્કેલીઓ દૂર થવાના દરવાજાઓ ઉપરથી પણ પહેરો હટાવી દેવામાં આવ્યો. એટલે કે નયાબતના દરવાજાઓ બંધ થઈ ગયા. ગયબતે કુબરાનો લાંબો સમયગાળો આવી ગયો. હવે આપણે શીયાઓને માટે મરજાઅના દરવાજાઓ ખટખટાવવાના દિવસો આવ્યા. અને આપણી રોજબરોજની આસાનીઓ માટે તકલીફનો માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો. ફીલો અને સાલેહોએ પોતાની મહેનત અને કાબેલિયતથી શરીઅતના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો સિલસિલો હુજરત હુજ્ઞત (અજ) સાથે કાયમ રાખ્યો. બયઅતની ભવ્યતા, તેની આબરૂ, તેનું મહૃત્વ, તેની તાજગી, તેની ખુશબુ, તાજા ફુલો ઉપર ધૂળ લાગવા ન દીધી. આપણા માટે મઅસુમીન (અ.) ની દોઓની સાથે તેની રીતભાત પણ અર્પણ કરી. એટલું જ નહીં બંદે કેટલો પરિશ્રમ વેઠ્યો હશે, કેટલાં દુઃખો સહન કર્યા હશે, કેટલા પ્રયત્નો, સંશોધનો અને ધાનબીન પછી ફીલો આપણને જ્ઞાનનો પ્રકાશ આપ્યો અને બયઅતનું અર્થઘટન કર્યું. અને તેના મૂળ અર્થથી જાણકાર બનાવ્યા કે “બયઅત માત્ર અલ્લાહના પ્રયગમભર અને મઅસુમી ઈમામો અલયહેમુસ્સલામની જ થઈ શકે છે. અને બયઅતને તોડવી ગુનાહે કબીરા છે.” બેહારુલ અન્વાર ભાગ દ૮ પાના ૧૮૫ના હવાલાથી આ લખાણ નકલ કરવામાં આવ્યું છે કે ઈમામ મુસા બીજી જાફર અલયહેમાસ્સલામે ઈરશાદ ફરમાયું :

“ત્રણ ચુનાહ અનેવા છે જે હુલાક કરીદે છે અને સખત અજાબમાં સપડાવી દે છે, બયઅતને તોડવી, સુશ્રતને તજ દેવી અને જમાઅતથી દૂર રહેવું.”

આ સમગ્ર લખાણો ખુલાસો એ છે કે બયઅતનું પ્રકરણ એક વિસ્તૃત ચર્ચા છે. જેનો એક ઐતિહાસિક મુદ્દો છે. જે સ્પષ્ટ શબ્દોમાં તેની ઓળખ કરાવે છે. બયઅતના સંદર્ભમાં ઈમાનની કેટલીક ગાણતરી છે, કેટલાક માપદંડ છે જેના ઉપરથી અલ્લાહના દીન ઉપર યકીન રાખનારાઓનું ચારિત્ય, બોલચાલ, રહનસહન બેસવા ઉઠવાની રીતભાત, ખોરાક અને પોશાક, સામૂહિક અને વ્યક્તિગત

સંબંધો, એ બધું જે જીવનની મૂડી છે તેને પરખી, તોલી અને માપી શકાય છે. તેના થકી આપણાને પોતાના અને પરાયા વચ્ચેનો બેદ જાણી શકાય છે. સમજદારીની સાથે જીવવાની એક રીત પેદા થાય છે. આપણાઓમાં જેણે બયઅતનો પણો પોતાના ગળામાં બાંધ્યો છે તેમાં પણ વિચાર અને દ્રષ્ટિના દરજાઓ ઉપર દરજાઓ છે.

આ દ્રષ્ટિથી તે સમયને નજર સામે રાખીએ જ્યારે અલ્લાહની હુકુમતની સ્થાપના થશે. જ્યારે અલ્લાહની હુજ્ઞત સમગ્ર જગત ઉપર છવાઈ જશે. જ્યારે અલ્લાહની મખલુક, સર્જનો અને બધા બંદાઓ અલ્લાહના ખલીફાની દેખરેખ હેઠળ હશે. જ્યારે સૌથી પહેલા ઈમામતનો સૂર્ય ગયબતના ઘનઘોર વાઢળોને હટાવીને પોતાનો પ્રકાશિત ચહેરો જાહેર કરશે. મકામે ઈખાહીમ હશે. કાબાની દિવાલો હશે, સૌથી પહેલાં ત૧ ત અલ્લાહના ખાસ બંદાઓ આગળ ધપરે. આપના હાથ ઉપર બયઅત કરશે. સવાર ખુશનુમા હશે. વાતાવરણ સાંત્વન આપનારું હશે. ઝસુલ અમીન અતસરનો છંટકાવ કરશે. સવારના મંદ પવનની લહેરો શાંતિ બખશશે. બયઅતના મુલ્યોનો માપદંડ સામે હશે. દિલની ઘડકનોમાંથી ફક્ત અલ્લાહને માટે અને ઈમામને માટેના નિખાલસ સૂરોનું રટણ અલ્લાહના નંમાઓમાં ભળી જઈને વાતાવરણને ખુશગવાર બનાવી દેશે. શરતો, વાયદાઓ અને વચનો હશે, વફાદારી હશે, દોસ્તી અને વફાની મહેર હશે, પાક તીનાત દ્રષ્ટ ઘરાવનારાઓને બયદે ખતરો બિલ્કુલ નહિ હોય. આ બયઅતનામું એ છે કે જેને પરહેજગારોના મવલા, સિદ્ધ પુરૂષ, રિસાલતના ઈદમના દરવાજા હજરત અલી ઈબ્ને અભી તાલિબ અલયહિસ્સલામે પોતાની બિલાફતના સમયમાં પોતાના શીયાઓને દેખિત રીતે આપી દીધું. જેથી આશાઓ તૂટી જવા ન પામે. નિરાશા પાસે ન આવે. પ્રતિક્ષા જીવંત રહે. વાસ્તવિકતાના પ્રકાશના કિરણો દેખાય. ઈન્શાઅલ્લાહ હજરતના ઝુહુર વખતે આપણે પહેલી સફમાં હશું.

અને અલ્લાહના જાહેર કરાએલા કરામતવાળા હાથો ઉપર બયઅત કરવાનું સન્માન પ્રાપ્ત કરશું. તે બયઅતનામું આ પ્રમાણે છે:

કાઓમ (અજ્ઞાલલાહો ફરજહું શરીફ)ના અસહાબો આપના હાથો ઉપર બયઅત કરે છે કે :

૧. ચોરી ન કરશું
૨. ઝીના ન કરશું.
૩. કોઈ મુસલમાનને ગાળ ન દેશું.
૪. ખુરેજી (જે હરામ છે) ન કરશું
૫. કોઈની આબરૂ ઉપર નજર ન નાખશું.
૬. કોઈ ઘર ઉપર હુમલો કરશું નહિ.
૭. કોઈને નાહક નહીં મારીયે.
૮. સોનું, ચાંદી, ઘવ, જવનો સંગ્રહ ન કરશું.
૯. યતીમનો માલ ન ખાશું.
૧૦. જે વસ્તુ નથી જાણતા તેની સાક્ષી ન આપશું.
૧૧. મસ્જિદને વેરાન ન કરશું.
૧૨. દારૂ અને નશાયુક્ત વસ્તુઓથી પરહેજ કરશું.

૧૩. રેશમ અને સોનાના તારવાળા કપડાં નહિ પહેરીએ.
૧૪. સોનાનો કમર-પછો નહિ પહેરીએ.
૧૫. ડાકુગીરી નહિ કરીએ.
૧૬. રાહદારી ઉપર તંગદીલી ફેલાવશું નહિ.
૧૭. સમાન લીંગની સાથે અપકૃત્યું થશે નહિ.
૧૮. ખાવાની વસ્તુઓ જેમકે ઘઉં અને જવને બરબાદ ન કરશું.
૧૯. થોડા ઉપર સંતોષ કરશું.
૨૦. અતરનો ઉપયોગ કરશું.
૨૧. ગંદદીથી દૂર રહેશું.
૨૨. સારા કાર્યો કરવાની પ્રેરણ આપશું.
૨૩. ખરાબ કાર્યોથી બચશું.
૨૪. જાડા કપડાં પહેરશું.
૨૫. માથાની નીચે માટીનો તકિયો રાખશું.
૨૬. ખુદાની રહેશું જે હક છે તે રીતે જેહાં કરશું.
- ઇથી અલયહિસ્સલામ તેઓ સાથે કોલકરાર કરશે :**
૧. તેમની સાથે રહેશું.
  ૨. તેમની જેવા કપડાં પહેરશું.
  ૩. તેમના વાહનો જેવા વાહન રાખશું.
  ૪. તેમની મરજી મુજબ કાર્ય કરશું.
  ૫. ઓછામાં ખુશ રહેશું.
૬. અલ્લાહ તબારક વ તાચાલાની મદદથી દુનિયાને ન્યાયથી ભરી રહેશું. જે રીતે ગુલમ અને અત્યાચારથી ભરી હશે.
૭. જે ઇબાદતનો હક છે તેવી ઇબાદત કરશું.
૮. પોતાના માટે કોઈ દરવાન કે ચોકીદાર રાખશું નહિ.

(કિતાબે જહાન બચાદ અઝ જૂહુર ૧૨૫-૧૨૬)

આજના શીયા સમાજને (પછી તે દુનિયાના ગમે તે ખુશામાં હોય) આ બયઅતની શરતો, વાયદો અને વચનો ઉપર ભરપૂર ધ્યાન આપવું જોઈએ. નાના હોય કે મોટા, ઓછું ભાણેલા હોય કે વધુ, દરેક આ બયઅતનામું જીવની જેમ રાખવું જોઈએ. જો આ બયઅતનામાની કલમો ઉપર ધ્યાન આપવામાં અને તેના ઉપર સમાજ અમલીકરણ કરે તો એક સંપૂર્ણ સ્વસ્થ, ખુશાહાલ અને પરિણામલક્ષી સમાજનું ઘડતર થશે. દરેક દ્રષ્ટિએ વ્યક્તિની આજાદીના રક્ષણને નજર સમક્ષ રાખવામાં આવી છે. આપ પોતાની ફૌજના સરદારો અને લશકર પાસેથી આ વચન લેશો કે નાહક ખુનામરકી નહિ કરે. તાકતના બળથી યતીમોના માલ ઉપર હુથ નહિ નાખે. વ્યભિચાર અને બીજા અપકૃત્યોથી દૂર રહીને પવિત્ર જીવન પસાર કરશે. જગમગાટવાળા કપડાથી પરહેજ કરશે. બીજાની સ્ત્રી ઉપર નજર નહિ નાખે. સાદા ખોરાક ઉપર સંતોષ માનશે. વિગેર... વિગેર. અહીં એક મુદ્દો છે કે માટી ઉપર તકિયો કરશું. આ વાક્ય વાસ્તવિક પણ છે અને સાક્ષિતિક પણ છે. એટલે કે એક સૈનિક માટે એબ નથી કે તે માટીને તકિયો બનાવે અને તે સરખામણી અખુતુરાબના પુત્રોના અનુયાયીઓ સાથેની છે. આ નભ્રતાની અને સાદગીની નિશાની છે. પછી તે દૂરદૂરના દેશોની સેવા કરવા જેવી જવાબદારી પણ કેમ ન હોય અને હુકમો આપવાની સત્તા પણ

પોતાના હાથમાં કેમ ન હોય.

આ બયઅતનામું એક ન્યાય કરનારને ન્યાયનું આમંત્રણ આપી રહ્યું છે. તેને દ્રષ્ટિ સમક્ષ રાખો. મૌલાએ- કાએનાતના જમાનાથી ૧૪ સાઢીઓ પસાર થઈ ગઈ. અને આ બયઅતનામું ઇતિહાસના પાનાઓ ઉપર તબ્દીલ થઈને -સફર કરીને- આપણા સુધી આવી ગયું છે. આ લાંબી મુક્તમાં સવાલ કરી શકાય છે :-

૧. શું સફરનો માર્ગ સંપૂર્ણ સંશોધનો અને સુરક્ષાનો મ્રબંધ થવા પછી પણ સલામત છે ?

૨. શું ખુરેજી-કટપતાતમાં કમી આવી છે ?  
સાચું તો એ છે કે દરેક પગલું ભયના માર્ગમાં પડી રહ્યું છે.

૩. શું માનવ-હકો ઉપર ત્રાપ મારવાની સંખ્યા ઓછી થઈ છે ?

૪. શું ચારે તરફથી નિરાધાર, નિઃસહાય, નિર્બળ લોકોના નિશ્ચાસ નથી સંભળાતા ?

આ બયઅતનામાની આશાએ આ ઘનઘોર અંધારામાં દુઝરો દિપકો પ્રગટાવી દીઘા છે. મઅસુમો (અ.)એ આ શીખ આપી છે કે દરરોજ સુખભના સમયે દરેક શીયાએ દોઓાએ અહદ શાંત ચિંતે એકાગ્રતાથી પડવી જોઈએ. તેના અર્થ અને મતલબ ઉપર ધ્યાન આપે. દોઓાએ અહદના આ વક્ય ઉપર ખૂબજ ચિંતન અને મનન કરે.

اللَّهُمَّ إِنِّي أَحَدُكَ لَهُ فِي صِيَحَةٍ يَوْمَى هَذَا وَمَا عَشْتُ مِنْ أَيَامٍ عَهْدًا وَعَقْدًا وَبِعَهْدٍ لَهُ فِي مُنْفَقٍ .....

એ અલ્લાહ ! આજના દિવસે, આ સવારના અને જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી તે હુઝરત (અજ)થી વાયદા અને વચનને દોહરાવું હું અને દોહરાવતો રહીશ અને તે હુઝરત (અજ)ની બયઅતની તોક મારા ગળામાં પહેરી રાખીશ. (દોઓાએ અહદ મજાતિહ - પા. ૫૪૨)

فِي صَيْحَةٍ يَوْمَى هَذَا

મારો દિવસ સુષ્પથી શરૂ થાય છે. દોઓાએ અહદ સંબોધન કરે છે. કસોટીનો દિવસ શરૂ થઈ રહ્યો છે. નફસનો હિસાબ કરવો જરૂરી છે. ત્યાગ અને બલીદાનનું ચલાશ બાકી રહે. અમીરો માટે રેહમદીલી અને વફાદારીનો સદેશ છે. ગરીબો માટે સંતોષની તાકીદ છે. પેટને ગંદકી અને હુરામથી બચાવી રાખો. આ દિવસ ચારિન્ય બનાવવાનો છે. વ્યક્તિત્વને શાશગારવાનો છે, શિક્ષણ અને સંસ્કૃતિનો છે. આવી બીજી સવાર આવશે પછી સૂરજ ઉપર ચઢશે. બપોર થશે ત્રીજા પહોરનો છાંચો ફળશે. સંદ્યાની કાલીમાં વધશે. રાત ઉંઘની ખુમારી લઈને આવશે. પછી નમાજ પઠનારાઓ માટે દોઓાએ અહદ કહેશે. છેવટે સાંભળનાર કહેશે :

وَأَكْحَلْ ناظرِي بِنَظَرَةِ مِنِّي إِلَيْهِ

“અને સુરમો લગાડી દો મારી આંખોમાં તેમના દીદારનો.”  
નિશાનીઓ બતાવી રહી છે કે તે સવાર નજદિક છે જે સીધો

(અનુસંધાન ૧૦માં પાના ૫૨)

## નાચેબે ખાસ બીજા

# જનાબા ધૌહુમદ બીજા ઉસ્માન સહીંદ લાઘવી

અલ-મુન્તજરના વાંચકો ૧૫, શાઅબાનુલ મુઅજ્જમ હિ. સન ૧૪૨૭ના વિશેષ અંકમાં “નયાબતની જરૂરત” અને હિ. સન ૧૪૨૮ના વિશેપ અંકમાં “પહેલા નાચેબે ખાસ” શિર્ખકો હેઠળના લેખોનો અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આ વરસે આ વિખ્યના અનુસંધાનમાં ત્રીજી કરી એટલે કે બીજા નાચેબે ખાસ જનાબ મોહમ્મદ બીજા ઉસ્માન બીજા સહીંદ અભ્રવી રીજવાનુલાઈ તથાલા અલયહેના જીવન ઉપર પ્રકારા પાડશું.

**કાલ ઈમામ હસન (અ.સ.) :** અદ્વાચ્ચ્રીયી વળોહુ સેક્તાને ફીમા અદ્વાચ્ચ્રી એલાક ફાન્ની યુદ્ધેયાન

“ઈમામ હસન અસ્કરી (અ.) એ ફરમાવ્યું : અભ્રવી (ઉસ્માન બીજા સહીંદ રીજ.) અને તેમના પુત્ર (મોહમ્મદ બીજા ઉસ્માન) બને ભરોસાપાત્ર છે. આ બને જે કાંઈ તમારા સુધી પહોંચાડે છે તે અમારા તરફથી પહોંચાડે છે.” (તારીખુલ ગયબતે અસ્સુગરા-સચ્યદ મોહમ્મદ બાકિકુ સસ્ક્ર કૃત પાના ૪૦૩)

**ઈમામ ઝમાના (અ.સ.) એ ફરમાવ્યું :** લમ યજલ સેક્તોના ફી હયાતીલ-અબ (રજી.)

“તેઓ પોતાના પિતા (ઉસ્માન બીજા સહીંદ (રજી.) ના ઝમાનાથી જ અમારા માટે ભરોસાપાત્ર અને વિશ્વસનીય છે.”

આપણા લાખો સલામ એ મહાન હુસ્તી ઉપર જેની કારકિર્દી માટે બે માસુમ ઈમામો (અ.) કહે છે કે મોહમ્મદ બીજા ઉસ્માન (રજી.) અમારા માટે વિશ્વસનીય અને ભરોસાપાત્ર છે.

અમે સાક્ષી આપીએ છીએ કે મોહમ્મદ બીજા ઉસ્માન (રજી.) (નાચી ગયબતમાં) જમાનાના ઈમામ સુધી પહોંચવાનો દરવાજો છે. આપે નયાબતના કાર્યને ખુબજ સુંદર રીતે પાર પાડ્યું. આપ અમીન પ્રતિનિધિ હતા. અને સાક્ષી આપીએ છીએ કે ખુદાએ આ નયાબત અને પ્રતિનિધિત્વના હોદાને પોતાના નુરથી મખ્સુસ કર્યા.

આ જ મઅરેફતની સાથે અમે આપની પરિસ્થિતિ જાણવા ચાહુંએ છીએ.

**નોંધ :** નયાબત અને પ્રતિનિધિત્વના મહાન હોદાના મહત્વનો અંદાજ અમે અગાઉના અંકોમાં આપી ચૂક્યા છીએ. નયાબત અને નાચેબેની ઓળખ પછી જનાબ મોહમ્મદ બીજા ઉસ્માનની જીવનશૈલી જાણીને જમાનાના ઈમામ અને તેમના નાચેબે અંગેની આપણી અકીદત વધુ દ્રઢ થઈ જશે.

**નામ, લક્ષ્ય અને કુશીયત :**

આપનું નામ મોહમ્મદ, આપના પિતાનું નામ ઉસ્માન અને દાદાનું નામ સહીંદ હતું. ઉસ્માન બીજા સહીંદના દાદા અમરૂ હતા.

તેથી આપના નામની સામે અભ્રવી (અભ્રી) લખવામાં આવે છે.

આ રીતે આપ ઈતિહાસમાં મોહમ્મદ બીજા ઉસ્માન બીજા સહીંદ અભ્રવી કહેવાય છે. આપની કુશીયત અબુ જાફર હતી. તે સિવાય

આપની બીજા કોઈ કુશીયત કિતાબોમાં નથી મળતી. આપના લક્ષ્યો અમરી, અસદી, કુફી, સમ્માન અને અસ્કરી પણ દર્શાવવામાં આવ્યા છે.

**વિદ્વાનોની દ્રષ્ટિએ આપનું મહત્વ :**

આ લેખની શરૂઆતમાં ઈમામે હોદા અલયહેમુસ્સલામથી આપની મહાનતાનો અંદાજો થઈ ચૂક્યો છે. હવે વિદ્વાનોના કથનો જુઓ :-

શયખ તુસી પોતાના પુસ્તક રેજાલમાં લખે છે : “મોહમ્મદ બીજા ઉસ્માન બીજા સહીંદ અમરવી, આપની કુશીયત અબુ જાફર અને આપના પિતાની કુશીયત અબુ અમરૂ છે. બને, જમાનાના ઈમામના વકીલ હતા. અને બને, તાએકે શીયા ઈમામીયા પાસે ઉચ્ચ સ્થાન ધરાવે છે.” (રિઝલે તુસી ૧૦૧ પાનું ૫૦૮)

આવા જ પ્રકારનું કથન અભાવા દીક્ષીએ પોતાની રેજાલ, (પહેલી) “મીમ” અક્ષર પ૮ નંબરમાં લખેલ છે.

મરહુમ મામકાનીએ તન્કીહુલ મકાલમાં લખ્યું છે કે આ વ્યક્તિ (મોહમ્મદ બીજા ઉસ્માન (રજી.)) નું સ્થાન અને ઉચ્ચતાનું મહાન હોવું અને આપની ઉચ્ચ કક્ષા ઈમામોના સાથીદારોની નજદિક કોઈ સ્પષ્ટીકરણ અથવા દલીલ કે પુરાવા ભેગા કરવા કરતાં વધુ મશાહુર છે.

આપના પિતાની જીવનશૈલીથી જણાય છે કે આપ પોતાના પિતાના જીવન દરમિયાન જ જમાનાના ઈમામ અલયહેમુસ્સલામની નયાબત અને વકીલાતની સનદ મેળવી ચૂક્યા હતા.

આપે આ વિષે મરહુમ મજલિસીનું પુસ્તક બેહારુલ અન્વારના હુવાલાથી લખ્યું છે.

આયતુલ્હાનુલ (ઉજ્મા સચ્યદ અબુલ કાસિમ ખુઈ (તાબ સરાહે) કિતાબ : મોઅજમુર-રેજાલુલ-હુદીસમાં લખ્યું છે :

“વર્ષે વાયાતો ફી જલાલતેહી વ અજમતેહી મકામેહી મોતાજ્જફરતુન”

“આપ (મોહમ્મદ બીજા ઉસ્માન (રજી.)) ના સ્થાન અને મરતબાની વિશેષતા અને મહાનતાના બારામાં જે રિવાયતો નકલ થઈ છે તે વધું વધારે છે.”

અમુક રેજાલના આલીમોએ આપને સંપાદક અને લેખક દર્શાવ્યા છે. તેથી એક ખુબજ જાણીતું અને મશાહુર કથન આ રીતે નકલ કરવામાં આવ્યું છે.

ઇબન નુહ (અબુલ અભાસ અહમદ બીજા અલી બીજા નુહ સયરાફી) કહે છે : અબુ નસે હેબતુલ્હાલ, (ઉમ્મે કુલસુમ મોહમ્મદ બીજા ઉસ્માનની દિક્કરી હતા. અબુ નસે હેબતુલ્હાલ (ઉમ્મે કુલસુમના નવાસા હતા) કહેતા હતા કે હ. અબુ જાફર મોહમ્મદ બીજા ઉસ્માને ફીકાહમાં પુસ્તકો

લખ્યા છે અને આ બધી હંડીસોને ઈમામ હુસન અસ્કરી અલયહિસ્સલામ, ઈમામ જમાના અલયહિસ્સલામ અને તેમના પિતા ઉસ્માન બીન સઈદથી (જે ઈમામ અલી નકી અલયહિસ્સલામ અને ઈમામ હુસન અસ્કરી અલયહિસ્સલામથી નકલ કરતા હતા) સાંભળી હતી.

આ બધી કિતાબોમાંની એક કિતાબ “અલઅશરબહુ” હતી. ઉમ્મે કુલસુમ બિન્ને અબુ જાફર (રઝી.) ફરમાવતા હતા : આ કિતાબ મોહમ્મદ બિન ઉસ્માન (રઝી.) ની વસીયત મુજબ હુસયન બીન રવહ (ગ્રીજા નાયબ)ની પાસે પહોંચી હતી. અને તેમના હાથમાં હતી. અબુ નસ્ર કહે છે હું માનું છું કે હુસયન ઈબ્ન રવહ પછી આ કિતાબ અબુલ હુસન સૈમુરી (ચોથા નાયબ)ની પાસે પહોંચી. (“અલ-ગયબહુ”-શાયખ તુસી કૃત, પાના ઉદ્ડત)

મરહુમ આયતુલ્લાહુલ ઉઝમા ખૂદું મોઅજમુર-રેજાલમાં આ હુદીસ પછી આ રીતે મંતવ્યો દર્શાવ્યા છે :-

આ રિવાયત બે બાબતોને સાબિત કરે છે :

(૧) મોહમ્મદ બીન ઉસ્માન (રઝી.) કિતાબના લેખક હતા.

(૨) આપે ઈમામ હુસન અસ્કરી અને ઈમામ જમાના (અલયહિસ્સલામ)થી રિવાયતો નકલ કરી છે.

### શિયાઓના મરજા અને આશ્રય સ્થાન :

જનાબ મોહમ્મદ બીન ઉસ્માન (રઝી.) ના જીવન ઉપર નજર કરીએ અને આપના થકી નકલ થયેલી હંડીસો અને આપના નામથી રજૂ કરવામાં આવેલ સૂચના પત્રો (તૌકીઆત)નો અભ્યાસ કરીએ તો સરળ રીતે સમજાય જો કે બધા ઈસ્લામી શહેરોના આપના બધા વકીલો ચર્ચા, ફીકાહ, સામૂહિક મસાએલો કે ગ્રશનો માટે આપની તરફ રજૂ થતા હતા. ઉદાહરણ રૂપે પ્રસંગ ટાંકીએ છીએ.

અબુલ હુસન અલી બીન અહુમદ દલાલ કુમ્મી કહે છે : “શીયાઓની એક જમાતમાં એ વાતનો મતભેદ થયો કે શું ખુદાવદે આલામે સર્જન અને રોજીની શક્તિ ઈમામોને સુપ્રત કરી છે કે નથી. કરી ? એક જમાતનું કહેવું છે કે આ અસંભવ છે, ખુદાના માટે આ જાઓડ નથી. કારણ કે શરીરોને ખુદાની સિવાય બીજું કોઈ પેદા કરી શકે નહિ. જ્યારે બીજી જમાતનું કહેવું છે કે ખુદાવદે મોતાલે ઈમામોને સર્જન કરવાની અને રોજી આપવાની શક્તિ અર્પણ કરી છે તેથી તેઓ સર્જન કરે છે અને રોજી આપે છે. આ અનુસંધાનમાં પ્રયંડ મતભેદ થયો. એક માણસે કહ્યું કે તમે અબુ જાફર મોહમ્મદ બીન ઉસ્માન અમરવી તરફ આ અંગે કેમ રજૂ નથી થતા અને તેમને આ સવાલ નથી કરતા જેથી તે તેમને સત્ય જાહેર કરે. તે ઈમામ જમાના (અલયહિસ્સલામ)ના પ્રતિનિધિ છે. બધા આ વાતથી રાજી થઈ ગયા અને અબુ જાફર પાસે રજૂ થયા. તેથી એક ચીહ્નીમાં આ સવાલ લખી તેમને સુપ્રત કરવામાં આવી. આપે ઈમામે જમાના (અ.) પાસે આ ચીહ્ની રૂજુઅ કરી. જવાબમાં એક તૌકીઅ આવી, જેમાં લખાણ હતું : નિશંક માત્ર ખુદાવદે મોતાલ શરીરોને પેદા કરે છે અને રોજીને વહેંચે છે. પરંતુ ન તો તે શરીર છે અને ન તો શરીરમાં પરિવર્તન કરે છે, અને કોઈ પણ વસ્તુ તેની પ્રતિકૃતિ નથી. તે (અલ્લાહ) સાંભળનાર અને જાણનાર છે. ઈમામો ખુદાવદે આલમ

પાસે માગે છે અને તે (અલ્લાહ) પોતેજ પેદા કરે છે. તેઓ ખુદાને દરખાસ્ત કરે છે તેથી તેઓની દરખાસ્તને કબુલ કરવા માટે અને તેઓના હક્કને વિશેષતા આપવા માટે તેઓને રોજી અને સર્જન ઉપર શક્તિ અર્પણ કરે છે.

આપની નયાબતનો સમય ઘણો લાંબો છે. અમે અગાઉ જણાવ્યું તે મુજબ આપ શીયાઓ માટે મરજા હતા. અસંખ્ય ઈલમ, ફીકાહ, સામૂહિક અને વ્યક્તિગત મસાલાઓ અને મુશ્કેલીઓનો ઉકેલ આપતા રવા છે. આ લાંબા સમયગાળામાં જે કંઈ સૂચનો-તવકીઓ ઈમામ જમાના (અ.) તરફથી મેળવી છે તે અક્ષરે અક્ષર વિષય અનુસાર જુદી જુદી કિતાબોમાં મોજુદ છે. જ્યારે અમુક કિતાબોમાં પૂરેપૂરી તવકીઅ એકજ જગ્યાએ નકલ થઈ છે.

એક ખૂબજ ખુલ્લવની તવકીઅ જે આપની મારફતે ઈસ્લાહ બીન યઅકુબના નામે સાદર થઈ છે તેનો અમુક ભાગ અહીં લખી રવા છીએ. આ તવકીઅ જુદાજુદા સવાલોના જવાબમાં આવી છે.

ઇસ્લાહ બીન યઅકુબ ફરમાવે છે કે આ તવકીઅ મારા મવલા ઈમામ જમાના (અ.)ના પવિત્ર હાથોથી લખેલી આ રીતે મળી : ખુદા તમારી હિદાયત કરે. અને સાચા અકીદા (ઉપર બાકી રાખે. અને જે રીતે તમે સવાલ કર્યો છે કે મારા ખાનદાનના અમુક લોકો અને મારા કાકાના દિકરા ભાઈઓએ મારા વજુદનો ઈન્કાર કર્યો છે. તો જાણી લો, ખુદા અને કોઈ વ્યક્તિની વચ્ચે સગપણ નથી. અને જે માણસ અમારા વજુદને નકારતો હોય તો અમારામાંથી નથી. અને જે માર્ગ ઉપર તે ચાલી રહ્યો છે તે નૂહ (અ.)ના દિકરાનો માર્ગ છે. અને જે માર્ગ અમારા કાકા જાફર અને તેમની અવલાદે અપનાત્યો છે તે યુસુફ (અ.)ના ભાઈઓનો માર્ગ છે.

આ તવકીઅનો બીજો વિષય : પરંતુ ફક્કાઅ (જવનો શરાબ) તેનું પીવું હરામ છે. પરંતુ શલમાબ પીવામાં કોઈ વાંધો નથી. (શલમાબ શયલમાંથી બનાવવામાં આવે છે, આ જવના દાણાની જેવા હોય છે.)

જ્યાં સુધી વાત છે તે માલોની જે તમે હંડીયાના નામથી અમને પહોંચાડો છો. તો અમે તે તમારા ગુનાહોને પાક કરવા ખાતર કબુલ કરીએ છીએ. તેથી જે ઈચ્છે છે તે અમને માલ પહોંચાડો છે અને જે નથી ઈચ્છાતા, નથી પહોંચાડતા. જે કંઈ ખુદાએ અમને આપ્યું છે તે વધુ સારું છે તેના કરતા જે કંઈ તમે આપો છો.

### જુહુરના સમયની કોઈને પણ ખબર નથી :

આ તવકીઅમાં આગળ ફરમાવે છે : મારા જુહુરનો સમય ખુદાવદે મોતાલાના હિરાદા સાથે સંકળાએલો છે. જે કોઈ જુહુરનો સમય નક્કી કરશે તે જુહો છે.

### માર્ગદર્શન :

અને જ્યારે નવા નવા બનાવો અને પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે અમારી રિવાયતોને રજૂ કરનારાઓ (હંડીસના રાવીઓ (ફીકાહો))નો સંપર્ક કરો. કારણ કે તેમારી ઉપર અમારી હુક્મત છે અને હું તેઓના ઉપર ખુદાની હુક્મત છું.

તે પછી હજરત (અજ)ની અમુક વાતો મોહમ્મદ બીન ઉસ્માન અમરી (રઝી.)ની વિશ્વસનીયતા, અલી બીન મહુજયાર

અહવાનીની શંકા અને તેને રદ કરવાની બરતરફીનો દોઆ, પછી ગાનારી ખીનો માલ હરામ હોવો, મોહમ્મદ બીન શાજાન બીન નઈમ નિશાપુરીની અહલેબ્યતના દોસ્તોમાં ગણુતરી કરવી, અબુલ ખતાબ મોહમ્મદ બીન અથી જયનબ અને તેના અનુસરનારાઓને મલઉન ગણવા, આ પ્રકારના બીજા ઘણા મહત્વના મસાલાઓ તરફ તાકીદ છે.

**સેહમે ઈમામનો અયોગ્ય ઉપયોગ :** ફરમાવે છે : અને જે લોકો અમારા માલ (સેહમે ઈમામ) ને પોતાની પાસે સંભાળીને રાખે છે, અગર જો તેમાંનો થોડો ભાગ પોતાના માટે હુલાલ ગણે છે અને ઉપયોગ કરે છે તો તે એવું છે કે તે લોકોએ આગ ખાંધી હોય.

**ગયબતનું કારણ ? :** અને ગયબતનું કારણ જે છે તે ખુદાવે આલમનું ફરમાન છે :

યા અચ્યોહુક્ષુણીના આમનું લા તસ્સલુ અન અશ્યાઅ ઇન તોબદલકુમ તસ્સલુકુમ (સુ. માએદાહ : ૧૦૨)

“એ ઈમાન લાવનારાઓ ! તમે એવી બાબતના બારામાં સવાલ ન કરો કે જો તમે જાણી લો તો તે તમને નારાજ અને દુઃખી કરે.”

**ઈમામે ઝમાનાના શિરે કોઈની પણ બયાત નહિ હોય :**

આજ તવકીઅમાં ફરમાવે છે :

મારા બાપ-દાદાઓ પોતાના સમયના જુદ્ધી હાકીમોની હુક્મતમાં જીવન પસાર કરી રહ્યા હતા. પરંતુ હું એવા જમાનામાં કયામ કરીશ જ્યારે કોઈ શયતાનની સત્તા મારી ગરદન ઉપર ન રાખતો હોઈશ. આજ તવકીઅમાં વાદળોની આડમાં સૂરજથી થતા ફાયદાના દાખલાથી ગયબતમાં ઈમામ (અજ)થી ફાયદાઓ જાણાવવામાં આવ્યા છે.

આ જ તવકીઅને મરહુમ શયખ સદ્ગુર (રહ.)એ કમાલુદીન ભાગ ૨/૪૮ ત હંદીસ નં. ૪, મરહુમ અલ્ફાદીમજલીસી (રહ.)એ બેઠારુલ અનવાર ભાગ ૫૩-૧૮૦ હંદીસ ૧૦માં દશાવિલ છે :

આવી જ રીતે ઈમામે ઝમાના (અજ)ની ઘણી તવકીએ જનાબ મોહમ્મદ બીન ઉસ્માન (રહી.) થકી મોકલવામાં આવી છે. થોડી બીજી વ્યક્તિએ જેમના નામે તવકીએ આવી છે તે નીચે મુજબ છે :

**અબુલ હુસૈન મોહમ્મદ બીન જઅફર અસદી :**

તેઓ રય શહેરમાં મોહમ્મદ બીન ઉસ્માન (રહી.)ના વકીલ તરફી કામ કરતા હતા. આપનું મૃત્યુ રખીયુસાની હિ.સ. ૩૧૨માં થયું. આપના જ નામ ઉપરની તવકીઅમાં લઘ્યું હતું કે નમાજ કાયમ કરો, જેમ તમે સૂર્યોદય અને સૂર્યાસ્ત થવાના સમયે નમાજ પઠવાના બારામાં સવાલ કર્યો છે અને જેમકે લોકો કહે છે અને તેવીજ રીતે હોય કે સૂરજ શયતાનની બે ડાળોની વર્ચ્યે ઉદય પામે છે અને બે ડાળોની વર્ચ્યે અસ્ત થાય છે તો પછી કોઈ વસ્તુ નમાજથી વધુ સારી શયતાનના નાકે માટી ઉપર નથી રગડતી (ઘસતી). તેથી નમાજને કાયમ કરો અને શયતાનનું નાક માટીમાં રગડી દો.

(કમાલુદીન ૨/૫૨૦ ભા.૪૮)

**પતિ-પત્નીના મતભેદનું સમાધાન :**

આ તવકીઅની વાત કરીએ તે પહેલા તેના અમલીકરણના

પાસાંઓ ઉપરની ચર્ચા બહેતર છે. પયગમ્બર અકરમ (સ.) અને અહુમમાં હોદા (અલયહુમુસ્લામ) ઉમ્મતના વાલીઓ છે. આ બાબત વિષે આ લેખમાં ઉપર લખાઈ ચૂક્યું છે કે ખુદાવે આલમે તેઓની ભવ્યતા અને મહાનતા ભાતર તેઓને ઘણી શક્તિએ અર્પણ કરી છે. આ હજરતો રોજ આપવાની શક્તિ ધરાવે છે. એટલે કે તેઓ જે વસ્તુની ખુદા પાસે માગણી કરે છે તે નકારતો નથી. આ તવકીઅમાં આ વાત ઉપર ઈશારો કરવામાં આવ્યો છે.

અબુ ગાલીબ અહુમમદ બીન મોહમ્મદ જોરારી કહે છે : મારી અને મારી પતિન વર્ચ્યે મોટો મતભેદ અને દુશ્મની પેદા થઈ ગઈ. અમારી વર્ચ્યે સમાધાનની બધી શક્તયતાએ પૂરી થઈ ગઈ. આ મતભેદ લાંબો ચાલ્યો. તેના કારણે હું ઘણી માનસિક તાણ અનુભવતો હતો. તેથી મેં એક પત્ર જનાબ મોહમ્મદ બીન ઉસ્માન (રહી.) ને આપ્યો કે તે તેને ઈમામે ઝમાના (અ.)ની સેવામાં પહોંચાડી આપે. આ પત્રમાં મેં દોઆ માટે દરખાસ્ત કરી હતી. પત્રના જવાબમાં ઘણું મોહું થયું. એક વખત અબુ જઅફર (મોહમ્મદ બીન ઉસ્માન (રહી.)) સાથે મુલાકાત થઈ ત્યારે આપે કહ્યું : તમારા પત્રનો જવાબ આવી ચૂક્યો છે. પછી તેમના ઘરે ગયો. એક ચોપડો કાઢ્યો અને તેના પાનાઓ ત્યાં સુધી ફેરવ્યા કે એક પત્ર મળ્યો અને મને દેખાડ્યો. જેમાં લખેલું હતું : પતિ અને પતિન અંગેનો જે પ્રશ્ન પૂછ્યો હતો તો ખુદાવે આલમે તેઓની વર્ચ્યે સુલેહ અને શાંતિ સ્થાપિત કરી દીધી છે.

અબુ ગાલીબ જોરારી કહે છે કે મારી પતિન હંમેશા કડકાઈથી વર્તન કરતી હતી. પરંતુ આ પ્રસંગ પછી ભૂતકાળના મતભેદોની જેમ કોઈ પ્રસંગ બનયો નહિ. બલ્કે હું ક્યારેક જાણીબુઝીને એવું કામ કરતો કે તેને ગુરુસે કરું. પરંતુ તેની તરફથી કોઈ પ્રતિભાવ જણાતો ન હતો. (પરે વહશીએ પૌરામુને ઝીન્દગાનીએ નુવ્વાબે ખાસે ઈમામે ઝમાના (અ.) (ઈમામે ઝમાના (અ.)ના ખાસ નવાબોના જવન) પાના ૧૭૬)

**મોહમ્મદ બીન ઉસ્માન અને ખોટા દાવા કરનારાઓ :**

ઈમામ અલી નકી અને ઈમામ હસન અસ્કરી (અલયહુમા સલામ) તે સમયની ખાસ પરિસ્થિતિ અને શરતોને કારણે લોકોના જાહેર સમૂહમાં ઘણા ઓછા જતા હતા. તેથી આપ હજરતો (અ.) એ ખાસ પ્રતિનિધિઓ નિય્યા હતા. જેથી ઈમામ અને સમાજ વર્ચ્યે સંપર્ક ચાલુ રહે. લોકો આ વ્યવસ્થાથી ટેવાઈ પણ જાય અને નાની ગયબત માટે પૂર્વ ભુમિકા બાંધી શકાય. ટૂંકમાં લોકોએ આ વ્યવસ્થાને સમજી લીધી અને તે રીતે ટેવાઈ પણ ગયા. નાની ગયબતમાં ખાસ નવાબો થકી પોતાની મુશકે લીઓને ઈમામ (અ.)ની સમય પહોંચાડવા લાગ્યા અને ઉકેલ મેળવવા લાગ્યા. અમુક કાચા ઈમાન, ટૂંકી દ્રષ્ટિ અને લેખાગુ લોકોએ લાભ લેવા ચાલ્યું અને સાહેબુલ અભ્ર (અલયહુસ્સલામ)ની નયાબતનો દાવો કરી બેદા. આ વિષય ઉપર આપ અગાઉના અંકોમાં ઘણા લેખો વાંચી ચૂક્યા છો, તેથી તેની વધુ જરૂર નથી. અલબત, અબુ જઅફર મોહમ્મદ બીન ઉસ્માન (રહી.)ના સમયમાં જે લોકોએ દાવો કર્યો તેઓના નામ આપી રહ્યા છીએ.

- (૧) અબુ મોહમ્મદ હસન શરીઈ
  - (૨) મોહમ્મદ બીન નસીર નુમૈરી
  - (૩) અહમદ બીન હીલાલ અભરતાઈ
  - (૪) અબુ તાહેર મોહમ્મદ બીન અલી બીન હીલાલ
  - (૫) અબુબક મોહમ્મદ બીન અહમદ બીન ઉસ્માન
- અબુબક બગદાઈ નામે ઓળખાતા. આ મોહમ્મદ બીન  
 ઉસ્માન (૨૯.)ના ભત્રીજા હતા.
- (૬) ઈસહાક અહમદ
  - (૭) બાકેતાની
  - (૮) હુસ્યન બીન મન્સુર હુલાજ

#### નોંધપાત્ર :

ઉપરોક્ત વ્યક્તિઓના બારામાં અગાઉના અંકોમાં વિસ્તારપૂર્વક વિગતો આપવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે આ બધી વ્યક્તિઓ જનાબ મોહમ્મદ બીન ઉસ્માનના હરીક હતા અને તેમની નયાબતનો ઇન્કાર કરતા હતા. તેમાંના મોટા ભાગના અકીદાઓ મર્યાદા ઓળંગી ચૂક્યા હતા. અમુક વ્યક્તિઓ ઈમામ, હાદી અને ઈમામ હસન અસ્કરી (અલયહોમા સલામ)ના જીવન દરમ્યાન ૪ હુદ ઓળંગનારા અને મલાઉન ગણાતા હતા. આથી તેઓ મોહમ્મદ બીન ઉસ્માન (૨૯.)ની કેટલી ઈર્ધ્યા કરતા હશે અને આપના કામોમાં કેટલી અડયારો ઊભી કરતા હશે તેનો અંદાજ આવી જાય છે. પરંતુ આપ ઈમામની મદદ હેઠળ આ બધા લોકોને પહુંચ્યો વળ્યા અને પોતાની નયાબતની ફરજ બજાવતા રહ્યા.

**મોહમ્મદ બીન ઉસ્માન ઉપર લોકોએ શા માટે વિશ્વાસ મુક્યો ?**

આપના નયાબતના સમયમાં ઈમામની નયાબતનો ખોટો દાવો કરનારાઓ લોકોને ભ્રમમાં નાખી અને છેતરપીડી કરીને તેઓની પાસે શરીઅતની રકમ ઉધરાવવા માગતા હતા. આ લોકો મોહમ્મદ બીન ઉસ્માન (૨૯.)ના વ્યક્તિત્વને દુષ્પિત કરવાની પેરવીમાં હતા. એક બાજુ આ એક ઘણો મોટો પડકાર હતો. લોકોને માટે ઈમામના નાએબની ઓળખ એક મુશ્કેલ કામ હતું. આવા સંઝોગોમાં લોકોને પોતાના વિશ્વાસમાં લેવા અને દુશ્મનોને મહાત કરવા તે ઘણું મોટું કામ હતું.

આપની નયાબત ઉપર વિશ્વાસ રાખવા માટેના કારણોમાં સૌથી મોટું કારણ એ જ તવકીઓ હતી જેમાં અકીદત, અખલાકી, સમાજ તથા ફીકહી મસાલાઓની સાથે સાથે ગેબી હુકમોની બાબતો હતી, જેના લીધે લોકો આપને સ્વિકરવા માટે મજબૂર હતા.

મોહમ્મદ બીન ઉસ્માન (૨૯.) દ્વારા ગેબી હુકમો અંગે અસંખ્ય પ્રસંગો પ્રકાશમાં આવ્યા છે. તે પૈકી એક પ્રસંગ અહિ નકલ કરીએ છીએ.

#### **ગયબની ખબર :**

જાનકારી બીન મોહમ્મદ મતીલ બયાન કરે છે કે અબુ જાનકાર મોહમ્મદ બીન ઉસ્માન સમ્માન, અમરવીના નામે ઓળખાય છે, તેમાંને મને બોલાવ્યો અને કપડાના થોડા ટૂકડાઓ, એક બટવો, એમાં થોડા દીનાર હતા, મને આપ્યા અને કહ્યું કે જરૂરી છે કે અત્યારે

જ વાસ્તવા (કુફ્ફા અને બસરાની વર્ચયેની જગ્યા) જાવ અને જે કાંઈ તમને આપી રહ્યો છું તે તમે તેને હવાલે કરી દેજો જે નદીની તરફ જતાં સૌથી પહેલાં તમારી સાથે મુલાકાત કરે. હું આ કામથી ઘણો નારાજ થયો અને વિચાર્યું કે મારી જેવો માણસ આવી મામુલી વસ્તુ લઈ જવા માટે પસંદ કરવામાં આવ્યો ? અંતે હું મારી સવારી ઉપર સવાર થયો અને વાસ્તવાની તરફ રવાના થયો. પહેલો માણસ જેની સાથે મારી મુલાકાત થઈ મેં તેને હસન બીન મોહમ્મદ કરતાત સયદલાની જે વાસ્તવામાં અવકાફના વકીલ હતા તેમના ખબર અંતર પૂછ્યા. તેણે કહ્યું હું જ છું. તેણે પુછ્યું કે તમે કોણ છો ? મેં કહ્યું કે હું જાનકાર બીન મતીલ છું. તે મને નામથી ઓળખાય ગયા અને સલામ કરી. મેં પણ સલામનો જવાબ આપ્યો અને આપસમાં ભેટચા. મેં તેમને કહ્યું કે અબુ જાનકાર અમરવીએ આપને સલામ કર્યા છે અને આ કપડા અને નાણાનો બટવો આપ્યો છે કે આપના હવાલે કરું. તેમણે કહ્યું અલહમ્દોલિક્ષાહ અહીં મોહમ્મદ બીન અબુલલાહ આમરી મરાણ પામ્યા છે અને હું તેમનું કફન લેવા જઈ રહ્યો છું. તેમણે જ્યારે બટવો ખોલ્યો અને જોયું તો તેમાં કફન દક્ફનના ખર્ચ માટેની રકમ હતી. હું જનાઓમાં શરીક થયો અને દક્ફન કરીને પાછો ફર્યો. (કમાલુદીન ૫૦૪ મ. તવકીઅાત, બેહાર : ૫૧/૩૭૬)

**નોંધ :** જો ઈમામે જમાના અલયહિસલામ મોહમ્મદ બીન ઉસ્માન (૨૯.)ને આ રીતે ખબર અથવા હિદાયત ન કરતે તો ક્યારે પણ આપને (મોહમ્મદ બીન ઉસ્માનને) આ બાબતોની જાણ ન થતે.

આ પ્રકારના એક બે પ્રસંગો નથી. જો નાએબોના જીવન પ્રસંગો ઉપર નજર દોડાવીએ તો આવા અસંખ્ય પ્રસંગો જોવા મળે છે, જે માં ઈમામે જમાના અલયહિસલામે આવી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હોય, જેની જાણ કોઈને પણ ન હતી.

વધુ જાણકારી માટે પુસ્તક કમાલુદીન લેખક શયખ સદ્ગુર અને બેહારુલ અન્વાર ભાગ-૫૧ લેખક અલ્લામા મજલીસીનો અભ્યાસ કરવો. બસે પુસ્તકોનો તરજુમો ઉર્કુમાં થઈ ચૂક્યો છે.

#### **મોહમ્મદ બીન ઉસ્માને નકલ કરેલી હંદીસો :-**

અસંખ્ય તવકીઓ છે જે ઈમામે જમાના અલયહિસલામે આપના હવાલે કરેલ છે. આ બધા લખાણો અને કથનો હંદીસ તરીકે આજે પણ જોવા મળે છે. પરંતુ તેમ છતાં પણ અહીં આ વિષય ઉપરની થોડી હંદીસો રજૂ કરીએ છીએ, કારણ કે ઈદ્મે રેજાલના અમુક આલીમોએ આપને ઈમામોની હંદીસ નકલ કરનારાઓની યાદીમાં આવરી લીધા નથી. પણ અમુક રેજાલના આલીમોએ તેમના આ રીતે દુર્લક્ષ સેવવા માટે ટીકા પણ કરી છે. આ આપણો વિષય નથી. હવે તે હંદીસો જૂઓ કે આપના થકી નકલ થઈ છે.

(૧) મોહમ્મદ બીન હુમ્મામ કહે છે : મોહમ્મદ બીન ઉસ્માન અમરી (કુદસુલ્હ રુહ) પાસેથી સાંભળ્યું કે નાહિયાએ-મુકદેસા તરફથી એક તવકીઅ મળી છે, એવા અક્ષરોમાં કે જે હું ઓળખું છું. (એટલે કે નાહિયા ઈમામે જમાના અ.થી) આ તવકીઅમાં આ રીતે લખેલું હતું :

મન સમ્માની ફી મજમઈન મેનમાસે બે-ઇસ્મી ફલયાસે

## લઘુનતુલ્લાદ

“જે કોઈ મને જાહેરમાં અને મહેરીલમાં મારા નામથી સંબોધન કરે તેની ઉપર ખુદાની લઘુનત થાય.” અનુભુ અલી મોહમ્મદ બીન હુમ્મામે કહ્યું કે ઈમામે જમાના અલયહિસ્સલામાની હજુરમાં એક પત્ર લખ્યો અને જુહુરના બારામાં સવાલ કરવામાં આવ્યો કે ક્યારે થશે ? જવાબમાં ફરમાવ્યું :

### કરોબ વક્કાતુન

“જે લોકો જુહુરનો સમય નક્કી કરે છે તે જુહ્ફા છે.”

(કમાલુદીન ૨/૪૮૨ ભાગ ૩ બેહારુલ અન્વાર ૫૧/૩૩)

**નોંધ :** ઈમામ મહુદી અલયહિસ્સલામનું નામ લેવાની મનાઈ કરવાની કડક સૂચના ખુદ હજરતે જ આ રીતે આપી છે :

ઇમસ્સુકૃત વજનત, વ ઈમલકલામ વસાર, ફિઝહુમ ઇન વક્ક અલદીસ્મે અગ્રાઉન્ડ વ ઇન વક્ક અલલ મકાને દલ્લુ અલચે

“નામ લેવામાં ચૂપકીદી રાખવી જોઈએ, જેથી જનતના હુકદાર થવાય અથવા તો (તેમના બારામાં) ચર્ચા કરો જેથી જહનમમાં નાખવામાં આવો. કારણ કે જો (સવાલ કરનાર) હજરતનું નામ જાણી લેશો તો તેનો ફેલાવો કરીને જાહેર કરી દેશે અને જો સ્થળને જાણી લેશો તો લોકોને કહી દેશે.” (બેહારુલ અન્વાર ૫૧/૩૫૧)

**નોંધ :** વસાએલુશ્શીયાના સંપાદકે ભાગ ૧૬ પ્રકરણ ૩ ત પાના નં. ૨૪૦ રિવાયત નં. ૨૧૪૬૦ હેઠળ નામ ન લેવાનું કારણ તકચ્ચા અને ભય દર્શાવ્યું છે.

(૨) અબુલ્લા બીન જાફર હુમૈરી કહે છે કે મોહમ્મદ બીન ઉસ્માન અમરવી (રહ.) ને કહ્યું કે મારી ઈચ્છા છે કે હું આપને એ જ સવાલ કરું જે હજરત ઈખાહીમ (અ.) એ ખુદાવણે આલમને કર્યો હતો અને કહ્યું હતું :

રજબે અરેની કચ્છ તોદ્વીલ મવત કાલ અવલમ તુમેનો કાલ :  
બલા વલાકીન લેયતમદીન કલબી

“એ ખુદા ! મને દેખાડ કે કેવી રીતે મુદ્દને જીવતા કરે છે.”  
ખુદાએ કહ્યું : “શું તમે ઈમાન નથી ધરાવતા ?” હજરત ઈખાહીમે કહ્યું : “કેમ નહિ ? (હા) પરંતુ ઈચ્છણ છું કે મારા દિલને સાંત્વન મળી જાય.” મને કહો કે સાહેબુલ અભને જોયા છે ? મોહમ્મદ બીન ઉસ્માન (રહ.) એ કહ્યું : હા, અને તેમની તોક આ રીતે છે. અને પોતાના હાથેથી પોતાની તોકની તરફ ઈશારો કર્યો. (કમાલુદીન બાબ “મન શાહેર અલ કાઓબી” હ : ૩)

(૩) અબુલ્લા બીન જાફર હુમૈરી કહે છે : મોહમ્મદ બીન ઉસ્માન અમરવી (રહ.) પાસેથી સાંભળ્યું, આપ ફરમાવે છે :

“ખુદાની કસમ ! સાહેબુલ અપ્ર (અ.) દર વરસે (હજની મોસમમાં) મકા આવે છે. આપ (અજ) લોકોને જૂથે છે અને તેઓને ઓળખે છે. લોકો પણ તેમને જુબે છે પરંતુ તેમને ઓળખતા નથી.” (સંદર્ભ : ઉપર મુજબ : હ. ૮)

### નોંધ :

મોહમ્મદ બીન ઉસ્માન (રહ.) એ ઈમામે જમાના અલયહિસ્સલામને ખાનએ કાબામાં એ કહેતા જોયાતેથી આ હદીસ પણ આપની જ પાસેથી નકલ થઈ છે :

“એ ખુદા ! જે કંઈ તે મારી સાથે વાયદો કર્યો છે તે પરિણામ સુધી પણોંચાડી હે.” (સંદર્ભ : ઉપર મુજબ : હ. ૮)

આપના જ થકી આ હદીસ પણ નકલ થઈ છે :- “મેં હજરત (સલવાતુલ્લાદ અલયહે)ને બાબુલ મુસ્તજારની પાસે ખાનએ ખુદાના પરદાને પકડીને અરજ કરતા સાંભળ્યા :

“ખુદાયા ! મારા થકી જ તારા દુશ્મનોથી બદલો લે.” (બેહારુલ અન્વાર ૨/૩૦)

ઈમામે જમાના (અલયહિસ્સલામ) ખુદા પાસે પોતાના જુહુરના ઈજનની રાહ જોઈ રહ્યા છે અને પોતાના જુહુર માટે દોઓા કરી રહ્યા છે. આપણે હંમેશા આપના જુહુરના માટે દોઓા કરતા રહેવી જોઈએ. ખાસ કરીને એ સ્થળો ઉપર જ્યાં દોઓાઓ જલ્દી કબુલ થાય છે. જે મેક હજ દરમિયાન અલ મુસ્તજાર ઉપર દોઓાએ સેમાત :

મશહુર અને જાણીતી દોઓા, દોઓાએ સેમાત જનાબ મોહમ્મદ બીન ઉસ્માન (રહ.) દ્વારા આવેલી છે. મફાતીહુલ જીનામાં આ દોઓા મોજુદ છે. તે પછ્યી મુસ્તબ છે. શયબ અખ્બાસ કુમ્મીએ તે અગાઉની શરૂઆતની કિતાબોમાંથી નકલ કરી આ દોઓા ઈમામ મોહમ્મદ બાકીર અને ઈમામ જઅફર સાદિક (અલયહેમાસ્સલામ) તરફથી પણ આવેલી છે. અથવા મજલીસી (રહ.)એ બેહારુલ અન્વારમાં તે વિસ્તારથી લખેલી છે.

**બની અખ્બાસના ખલીફાઓ :**

જનાબ મોહમ્મદ બીન ઉસ્માનના નયાબતના સમય ગણામાં જે ખલીફાઓએ હુકમત કરી તેઓના નામ નીચે મુજબ છે :

૧. મોઅતમીદ બિલ્લાદ હી. ૨૫૬થી ૨૭૮
૨. મોઅતમીદ બિલ્લાદ હી. ૨૭૮થી ૨૮૮
૩. મુક્તાફી બિલ્લાદ હી. ૨૮૮થી ૨૮૫
૪. મુક્તાદીર બિલ્લાદ હી. ૨૮૫થી ૩૨૦

**નયાબતની મુદ્દત :**

રેઝાલના આલીમો વર્ચ્યે મશહુર છે કે આપની નયાબતની મુદ્દત લખગ ૫૦ વરસ છે. પરંતુ આ કથન સ્વિકાર્ય નથી. કારણ કે મોહમ્મદ બીન ઉસ્માન (રહ.)નું મૃત્યુ હિજરી ૩૦૫માં થયું. ઈમામ હુસન અસ્કરી અલયહિસ્સલામથી તેનું અંતર ૪૫ વરસ છે. ગયબતે સુગરા ઈમામ હુસન અસ્કરી અલયહિસ્સલામની શહાદત પછી જ ગાગવામાં આવે છે. એટલે ૪૫ વરસામાં પહેલા નાઅબનો નયાબતનો ૫ વરસનો સમય આવી જાય છે. આ રીતે બીજા નાયબની નયાબતની મુદ્દત ૪૦ વરસ થાય છે.

**વફાત :**

આપની વફાત જમાદીહુલ ઉલા હિજરી ૩૦૫માં થઈ હોવાનું નકલ થયું છે. અમુક લોકોએ હિજરી ૩૦૪ પણ લખી છે. પરંતુ અબુ ગાલીબ જોરારીએ જે ઈજન રવણ (રહ.)ના કુફામાં વકીલ હતા અને મોહમ્મદ બીન (રહ.)ના નજદિક ગણાતા હતા તેમણે હિજરી ૩૦૫ લખી છે. સંશોધકોએ આ લખાણને અગ્રતા આપી છે.

આપની વફાતના બારામાં આપે પોતે જ બે મહિના પહેલા આગાહી કરી હતી. અબુલ હુસન અલી બીન અહમદ દલાલ કુમ્મી

લખે છે કે એક દિવસ હું મોહમ્મદ બીન ઉસમાન (રહ.) પાસે ગયો. મેં જોયું કે એક તકતી તેમની સામે છે અને તેની ઉપર આપ એક નકશો દોરી રહ્યા છે અને કુરઆનની આયતો લખી રહ્યા છે. અને તેના હાંસીયામાં ઈમામોના નામ લખી રહ્યા છે. મેં સવાલ કર્યો કે આ કેવી તકતી છે? તેમણે કહ્યું કે આ મારી કબર માટે છે અને મને આની ઉપર રાખવામાં આવશે. અથવા એમ કહ્યું કે તેની ઉપર તકીયો કરીશ. વધુમાં કહ્યું કે હું દરરોજ મારી કબરમાં દાખલ થાવ છું અને કુરઆનનો એક પારો પહુંચ છું અને બહાર આવું છું. એક રિવાયતમાં છે કે તે પછી અખુલ હુસન અલી બીન અહુમદે કહ્યું કે મોહમ્મદ બીન ઉસમાન (રહ.) એ મારા હાથને પકડ્યા અને પોતાની કબર પાસે લઈ ગયા. કબર દેખાડીને કહ્યું કે જ્યારે ફલાણો દિવસ ફલાણો મહિનો અને ફલાણું વરસ આવશે ત્યારે હું ખુદાની બારગાહમાં ચાલ્યો જઈશ અને આમાં દફન થઈશ. અને આ તકતી પણ મારી સાથે હશે. મેં તેમની વાતોને યાદ રાખી લીધી અને નક્કી તાંબેલ સમયની રાહ જોતો રહ્યો. થોડાં જ દિવસો પછી તે બિમાર થયા અને અંતે બતાવેલા દિવસે, મહિને અને વરસે આપ મૃત્યુ પામ્યા. અને એ જ કબરમાં દફન થયા. (તારીખે સિયાયે ગયબતે ઈમામે દવાજદહુમ પા. ૧૭૦)

આ પ્રમાણેની રિવાયત મોહમ્મદ બીન અલી બીન અસ્વદે કુમ્મીએ પણ નકલ કરી છે. જુઓ : બેદાર જી. ૫૧, પા. ૩૫૧, કમાલુદીન જી.૨/૫૦૨ દ. ૨૮)

### ઈમામના નાએબની જીયારત :

જેના દિલો ઉપર મહોર લાગી જાય છે તે શું ઈમામ મહુદી અલયહિસ્સલામને ઓળખશે !

દિલ ઉપર લાગેલી એ મહોરનો નાશ કરવા માટે જરૂરી છે કે મોહમ્મદ બીન ઉસમાન (રહ.) ની કબર ઉપર જાય અને જુએ કે આજે પણ ઈમામના નાએબના અસ્તિત્વનો પૂરાવો આપી રહી છે. બગાદની પૂર્વે ખૂબજ ગીર્દાવાળા સ્વરચ્છ અને ધાંધાવાળા વિસ્તારમાં એક મસ્જિદ કે જે ખલાનીના નામથી મશહૂર છે તેમાં જ આપની કબર છે અને આજે પણ ઈમામના નાએબનો અકીદો ધરાવતા લોકો આપની જીયારત કરે છે અને કહે છે :

હું એ વાતની સાક્ષી આપું છું કે આપ મારા મવલાના રહુમતના દરવાજા હો.. હું આપના આ હકને ઓળખિને (આપની સેવામાં) આવ્યો છું જેના ઉપર આપ મક્કમ રહ્યા અને મને ખબર છે કે આપે સેદેશા પહુંચાડવામાં અથવા નાએબની ફરજમાં કસર નથી કરી. સલામ થાય આપ ઉપર એ સૌથી વિશાળ રહુમતના દરવાજા. (મફાતીહુલ જીનાન તરજુ મો (ઉર્દુ) અખામા અલ જવાડી પા. ૮૬૭)

### (રથા પાના પરથી ચાલુ)

માર્ગ દેખનાડનારના ચહેરાના અનેક રંગોનો પ્રકાશ લઈને આવશે. પવિત્ર ચાહુનારાઓના સમૂહો આપની આજુ બાજુ હશે. બયઅતનામું, જે આપના દાદાએ ઈતિહાસના પાનાઓ ઉપર સુરક્ષિત કરી દીધું છે તે આપ પોતાની સામે રાખશે. આગેવાનો

અને વાયદો દેનારાઓ સાથે કોલ અને કરાર થશે.

### રજાત :

રજાત થશે. તિરડો પેલી કબરોના મોટાઓ ખુલી જશે. પ્રતિક્ષા કરનાર મુનત્જેરીન જેઓએ રાતના જાગીને, રાતોને જવંત રાખી છે, તેઓ કફન ખબા પર રાખી ભાલાને સંભાળતા હોઠો પર લખ્ખેકના અવાજ સાથે, આં હજરત (અજ.)ની અવાજ પર આપ (સ.)ની ખીદમતમાં હાજર થશે. દોઆએ અહુદની સનદ હુશે એટલું જ નહીં બલ્કે દોઆએ અહુદની સર્વાચિ બોલશો કે આ તે છે જે દરરોજ સવારે બયઅતને દોહરાવતા હતા અને કેહતા હતા :

عہدًا و عقدًا و بيعة له في عنقي

એ અદ્ધારું તથારક વ તથાલા તારા રહેમ અને કરમથી અમારી ગંધીઓને સ્વરચ્છતામાં બદલી દે. અમને શરીરની સ્વરચ્છતા અને દિલની સ્વરચ્છતા અર્પણ કર. અમારી આંખોની અને રૂહની દ્રષ્ટિ અને સમજશક્તિને બચાવી લે. આરોપોનું જોર છે તેનો સામનો કરવાની શક્તિ અર્પણ કર. જે માતાઓના ખોળામાં આ કોમ ઉછરી રહી છે તેઓને જનાબે જ્યનબ (અ.)ની સબર, ઈલમ, નભતાના પ્રકાશનું એક કિરણ અતા કર અને તે બીબીની ચાદરના સંકે અમારી નારીઓને (ખિઓને) પદની તૌફીક આપ, જેથી આ હજરત (અ.)ના લશ્કર માટે એવા વારસદારોનો ઉછેર કરે જે તે સમ્યે જ્યારે નાશોરીલ અદ્દલ ફીતાલે વલબર્જ નો દરબાર શાશગારેલો હોય અને હુગુરે આસમા જનાબ, અજ્ઞલક્ષ્માદો તથાલા ફરજહુ શરીફ, ઈલાહી હુકુમતના પ્રણેતા હોય તે વાતાવરણમાં હાજર થાય અને તેમની બયઅત કરવાનું સંમાન પ્રાપ્ત કરે.


### (૧૬મા પાના પરથી ચાલુ)

ઈમરાન : ૮) કોણ છે જે ખુદાથી વધુ વાયદો વકા કરે છે ? કોનો વાયદો ખુદાના વાયદાથી વધુ વિશસનીય છે ? યકીનથી કોઈ નહિએ. માત્ર અદ્ધારનું કથન પૂરતું છે. પરંતુ શું કહેવું તે વાયદાનું, જેની જામીનગીરી પણ અદ્ધારે લીધી છે. આજે આપાણી ફરજ છે કે આજ વાયદાનો ઈન્ટેજર કરીએ. તે વ્યક્તિત્વનો કે જેના સંબંધે જિયારતોમાં મળે છે :

“સલામ થાય હજરત મહુદી (અ.) ઉપર તે કે જેના કારણે અદ્ધાર, અજ્જ વ જ્યે, ઉમતો સાથે વાયદો કર્યો છે કે તે આપ (અજ.)ના થકી પોતાની (અદ્ધારની) મખ્લુકાતને જમા કરશે, આપ (અજ.) થકી જ વેરવિભેર થઈ ગયેલ પરેશાન લોકોને ભેગા કરશે. આપના જ થકી જમીનને અદલ અને ઈન્સાફથી એવી રીતે ભરી દેશો જે રીતે તે જુદ્દમ અને અત્યાચારથી ભરાએલી હશે. આપના જ થકી મોઅમીનોના વાયદાને પૂરો કરશે.”

(મફાતીહુલ જીનાન પા. ૫૩૦ આદાબ સરદાબ)

જીયારત આમ તો ઘણી લાંબી છે. દોઆ કરીએ છીએ કે જો છંદળી રહે અને અદ્ધારની તૌફીક અને મદદ ભળે તો જીયારતના બાકીના ભાગનું વિસ્તરણ આવતા વર્ષે આપની સેવામાં રજુ કરીશું. -ઇન્શાઅદ્ધાર.



## જીયારતે આલે યાસીનનું વિવરણ

આપ જાણો છો તેમ દર વરસે શઅભાનના વિશેષ અંકમાં અમે ઈમામે જમાના (અ.) સંબંધિત એક દોઆ અથવા જીયારતનું વિવરણ (તફસીર) અને તરજુમો આપની સેવામાં રજુ કરીએ છીએ. આ વરસે જે જીયારતને પસંદ કરી છે તે જીયારતે આલે યાસીનના નામથી જાણીતી છે.

### (અ) જીયારતે આલે યાસીનની સાબિતી (સનદ) :-

આ જીયારતને નામાંકિત અને મહાન શીયા વિદ્ધાનોએ પોતાની કિતાબોમાં નકલ કરી છે. અને તેના રજુ કરનારને વિશ્વાસને પાત્ર ગાડ્યા છે. અહીં અમે થોડા પુસ્તકોના નામ રજુ કરીએ છીએ જેમાં આ જીયારત મૌજૂદ છે. (પંજેતને પાક (અ.)ની સંખ્યાની બરાબર અમે પાંચનો હવાલો આપીએ છીએ.)

(૧) અલ એહેતેજાજ, ભાગ-૨ પા. ૩૧૬-૩૧૮ :

આ અમુલ્ય પુસ્તક આ જીયારતનો સૌથી પહેલાના સમયનો હવાલો છે. તેના સંપાદક મહાન હૃદીસકાર અબુ મન્સુર અહુમદ બીન અલી બીન અભીતાલીબ તબરસી (રહ.) છે, જે છુટી સદી હીજરીમાં જીવન પસાર કરતા હતા. આપની ગાણના શીયાઓના સૌથી મહાન ઉસ્તાદ અને આગેવાનોમાં થાય છે. રેજલના આલીમોના સમૂહે તેમને તેમની મહાનતા અને વિશેષતા માટે યાદ કર્યા છે.

(૨) બેહારુલ અન્વાર : શયખુલ ઈસ્લામ, ફખરુશ શીયા, શરીઅતની પનાહગાહ, અલ્ઘામા શયખ મોહમ્મદ બાકીર મજલીસી (રહ.) આ ભવ્ય અને મહાન કિતાબના સંપાદક છે. જીયારતે આલે યાસીનનું મહત્વ નજર સામે રાખીને આપે તે બેહારુલ અન્વારમાં ત્રાણ જગ્યાએ નકલ કરી છે. (અ) ભાગ ૫૩ પાના ૧૭૧-૧૭૩ ઈમામે અણ. (અ.જ.)ની તવકીઓના પ્રકરણમાં

(બ) ભાગ-૮૪ પાના ૨-૫ કિતાબુજ્જીક વદદોઆમાં

(ક) ભાગ-૧૦૨ પાના ૮૧-૮૩ કિતાબુલ મજારમાં

(૩) ફવઝ અકબર દર તવસુલાત બે ઈમામ મુનતજર (અ.) પાના ૬૮-૭૦. હુક્કતુલ ઈસ્લામ મરહુમ મીર્જા મોહમ્મદ બાકીર ફકીહે ઈમાની, આ કિતાબના સંપાદક છે. ખાસ તો એ છે કે જીયારતમાં સૌથી પહેલી આ જીયારત છે.

(૪) તકાલીફુલ અનામ ફી ગયબતીલ ઈમામ : પાના ૧૩૫-૧૩૮ મરહુમ સદરુલ ઈસ્લામ હમદાનીએ પોતાની આ રસપ્રદ કિતાબમાં પચ્ચીસમી જવાબદારીના પ્રકરણમાં આ જીયારત લખી છે.

(૫) મફાતીહુલ જીનાન : (ઉર્ડુ તરજુમો મરહુમ અલ્ઘામા જીશાન હૈદર જવાદી પ્રકાશ : તન્જીમુલ મકાતીબ (લખનવ) પાના ૮૫૬-૮૫૮

આ પ્રખ્યાત મજબુઆના સંપાદક, હૃદીસકારોમાં વિશ્વસનીય, મરહુમ મબતુર હાક્ક શયખ અબ્બાસ કુમ્મી (રહ.) છે. નોંધપાત્ર બાબત એ છે કે આ જીયારત પહોંચાઉનાર અબુલ્લા બીન જાફર છે, જે હીજરી સન ૨૪૦ની પહેલા અને હીજરી સન ૩૦૦ પછી સુધીના જીવન દરમ્યાન કેદમાં રહ્યા (કરબુલ અસનાદ ૨, ૩) આ મહાન રિવાયત કરનાર એ છે કે જેમાણે શયખ સદુક (રહ.) ના પિતા અલી બીન બાબવયા મોહમ્મદ બીન અલ હુસન અલ વલીદ (રહ.) (શયખ સદુક રહ.ના ઉસ્તાદ) અને મરહુમ મોહમ્મદ બીન યઅકુબ કુલયની (રહ.)થી આ જીયારત અને બીજી હૃદીસો નકલ કરી છે.

તેથી સનદને વિશ્વાસપાત્ર હોવામાં કોઈપણ પ્રકારની કોઈ પડા શક્યતા બાકી નથી રહેતી.

### (બ) જીયારતે આલે યાસીનની વિશેષતા :

આ જીયારતની વિશેષ બાબતોમાંની એક વિશેષતા એ છે કે આ જીયારતના મોઅલ્લીમ (શીખવાડવા વાળા) ખુદ જીયારતના સંબોધનકર્તા છે. (એટલે જેમને જીયારતમાં સલામ કરવામાં આવી છે તેઓ પોતેજ આ જીયારત શીખવા વાળા છે.) આ પ્રકારની જીયારતો ઘણી ઓછી છે, કારણ કે મોટા ભાગની જીયારતો એક માઅસુમ તરફથી બીજા માઅસુમની શાનમાં આવેલી છે. જેમકે ઈમામ સજ્જાદ (અ.) એ અમીરુલ મોઅમેનીન (અ.)ની જીયારતનું શિક્ષણ આપ્યું. ઈમામ સાદિક (અ.) એ જીયારતે સચ્ચદુરશોહુદુદા (અ.)નું વાર્ષિન કર્યું. ઈમામે અસની તરફથી જનાબ હુમયરી (રહ.) (આ જીયારતના વાર્ષિન કરનાર)ની પાસે પત્ર આવ્યો. તેમાં સવાલોના જવાબો પછી લખ્યું હતું :

“રહેમાન અને રહીમ ખુદાના નામથી. તમે લોકો ન ખુદાના હુકમને સમજો છો અને ન તો તેના વલીઓથી એ હુકમોને કબુલ કરો છો. આ (ઇમામ) અલ્ઘાની સંપૂર્ણ હિક્મત છે. પરંતુ લોકોને ડરાવવાથી પણ લાભ નથી થતો. સલામ થાય અમારા ઉપર અને અલ્ઘાના પરહેજગાર બંદાઓ ઉપર. ટૂંકમાં જ્યારે પણ ઈચ્છો કે અમારા થકી ખુદાની તરફ કે અમારી તરફ ધ્યાન કરો તો એ રીતે કહો જે રીતે પરવરણગારે ફરમાવ્યું છે :

سَلَامُ عَلَيْكُمْ يٰ مُسَيْبَةٍ

તો આવો ! હુક તાદ્વાલાની બારગાહમાં દોઆ માણીએ કે તે આપણને શક્તિ આપે કે આ અમુલ્ય જીયારતના અર્થધંતને સુજ્ઞ વાંચકો સુધી પહોંચાડી શકીએ. (અલબત્ત ટૂંકાવીને લખ્યું આવશ્યક છે.)

## (ક) સલામ અને દુર્દિનનું વિસ્તૃત વર્ગના :

سَلَامُ عَلَى إِلٍ يَسَّ

“આલે યાસીન ઉપર દુર્દિન અને સલામ”

એટલે કે રસૂલે અકરમ (સ.) ના કુટુંબ અને અહુલેભયત (અ.)

ઉપર સલામ. આ પહેલા સલામમાં એક ખાસ શિષ્ટાચાર અને પવિત્રતા સમાંગેલી છે. જોકે આ જીયારત ઈમામે જમાના (અ.) ની જીયારત છે અને તેની પછીના જેટલા સલામ અને દુર્દિન છે તે સર્વે આપની જાતથી ખાસ અર્થમાં આવેલા છે, પરંતુ જીયારતની શરૂઆત આપના સમગ્ર કુટુંબ ઉપર સલામ મોકલવાથી થાય છે. જાહેર રીતે રિસાલતના ખાનદાન ઉપર સલામ અને આલે યાસીનનું શિર્ષક કુરાનાને કરીમની બે આયતો ઉપરથી લેવામાં આવ્યા છે. એક યાસીનના સુરાની પહેલી આયત (યાસીન) અને બીજી સાફકાતના સુરાની ૧૩૦મી આયત (સલામુન અલા ઈલયાસીન). ઈમામ સાદિક (અ.) ને પૂછ્યામાં આવ્યું : એ રસૂલે ખુદા (સ.) ના ફરજના ! અલ્લાહનો કોલ ‘યાસીન’નો શો અર્થ છે ? આપે ફરમાવ્યું :

اَسْمَ مِنْ اَسْمَاءِ النَّبِيِّ وَمَعْنَاهُ يَا اَيُّهَا السَّامِعُ الْوَحْيُ

(માનીયુલ અખભાર પા. ૨૨ તફસીરે બુરહાન ભાગ ૨ પા. ૩). “આ નબી કરીમ (સ.) ના નામોમાંથી એક નામ છે અને તેનો અર્થ છે હે અલ્લાહની વહીને સાંભળનાર.” જ્યાં સુધી સુરા સાફકાતની આયતનો સવાલ છે ત્યાં સુધી તફસીરકારો અને કુરાનની કિરાત કરનારાઓ જેમકે “નાફેઅ” ઈબ્ને આમીર અને યઅકુબે આ આયતને “આલે યાસીન” પઢ્યા છે અને યાદ કર્યું છે. ઈલયાસીન (ખરેખર આલે યાસીન છે) (તફસીર અખુલ ફતુહ ભા. ૮ પાના ૩૮, તફસીરે મજમુલ બયાન ભા. ૮, પા. ૪૫૬). આ ઉપરાંત અહુલેભયત (અ.) ની હંડીસો પણ આ અર્થવટને ટેકો આપે છે. ઉદાહરણ રૂપે ઈમામ સાદિક (અ.) એ પોતાના પરદાદા અમીરુલ મોઅમેનીન (અ.) ની આ રિવાયત નકલ કરી છે. આપે આ પવિત્ર આયત સલામ ઉપરાંત આલીયાની વિસ્તૃત વર્ગના :

يَسْ مُحَمَّدٌ وَتَحْنُ أَلْ يَسٌ

અર્થાત : યાસીન મોહમ્મદ છે અને અમે (અહુલેભયત) આલે યાસીન છીએ. (તફસીરે બુરહાન, ભા. ૨, પા. ૩૩). વધુ વિગત માટે બેહારુલ અન્વાર ભા. ૨ ૩ પા. ૧૬૭ થી ૧૭૧ (બાબ : અત્ આલે યાસીન, આલે મોહમ્મદ (સ.)) તરફ રૂજુઅ કરી શકાય છે.

અહુલે સુનના મહાન તફસીરકારો જેમકે કરતબી (ભા. ૧૫ પા. ૧૧૮) અને તફસીરે રૂહુલ માનીની-આલુસી (ભા. ૨ ૩ પા. ૧૪૨) એ પણ આ માન્યતાને રજુ કરી છે.

السَّلَامُ عَلَيْكَ يَا دَاعِيَ اللَّهِ وَرَبِّيَّ أَيَّاتِهِ لَكَ

“સલામ થાય આપ ઉપર, એ અલ્લાહની તરફ દુર્દિન દેનારા અને એ અલ્લાહના સર્જનોના સરપરસ્ત અને ઉછેર કરનારા.”

આ વાક્યમાં પહેલું દુર્દિન ખાસ ઈમામે જમાના (અ.) ના પવિત્ર અસ્તિત્વ ઉપર છે. હજરત (અજ) વિશે સદગુણોમાંના બે સદગુણો સમાંગેલા છે.

૧. દાખેયલાહ

૨. રખબાનીચ્યે આયત

પહેલો સદગુણા “દાઈ” ઈસ્મે ફાઅલ છે. તેનો અર્થ થાય છે દુર્દિન દેનાર. એટલે ઈમામે જમાના (અ.) લોકોને અલ્લાહની તરફ દુર્દિન દેનાર આપે છે.

અલ્લાહની તરફની દુર્દિનનું સ્થાન (ઓદધો) :

જે આ પવિત્ર જીયારતનું પહેલું વાક્ય છે તે ઈમામે અસ્તના સર્વોચ્ચ અને સર્વશ્રીષ્ટ સ્થાનોમાંથી-ઓદધાઓમાંથી છે. કારણ કે હિજરી સન ૨૬૦થી લઈને આજ સુધી અને આજથી નક્કી કરેલા સમય સુધી ઈમામે જમાના (અ.) અલ્લાહ તરફ આમંત્રણ આપનાર હતા, છે અને રહેશે. બીજો ગુણ “રખબાની” ગુણ છે. મરહુમ તરીકી લખે છે કે કશશાફ (ઝમખશરી)માં આવ્યું છે કે રખબાની તૈને કહે છે કે જેનો દીનથી લગ્નાવ અને ખુદાની તાબેદારી મજબુત અને મજકુમ હોય. કામુસમાં છે કે એક ખુદા પરસ્ત અને ખુદાની ગ્રસંશા કરનાર ઈન્સાનને રખબાની કહે છે. મરહુમ તબરસી લખે છે કે જે લોકોના કાર્યોને સુધારે અને સલાહ, સુચનો થકી કામને પાર પાડે તેને રખબાની કહે છે. જેમકે હંડીસમાં છે :

لَا عِلْمَ إِلَّا مِنْ عَالِمٍ رَبِّيَّ

“‘હંમ નથી પરંતુ આલીમે રખબાનીની પાસે.’” (મજમુલ બહરયન ભા. ૨ પા. ૬૫ હુરુફ “રબ બ”) આ અર્થને દ્રષ્ટિ સમક્ષ રાખીને જીયારતના વક્યને આ રીતે કહી શકાય છે કે સલામ થાય આપ ઉપર, એ ખુદાના દીન તરફ દુર્દિન દેનાર અને ખુદ ખુદાના દીન. આપની તાબેદારી ખુદાની તાબેદારી છે. સલામ થાય આપ ઉપર એ અલ્લાહની નિશાનીઓના સરપરસ્ત અને ઉછેર કરનાર. ખુદાવે સુખદાને પોતાની બધી નિશાનીઓ અને સર્જનોના ઉછેરની જવાબદારી પોતાના ઘારા હજરત મોહમ્મદ મુસ્તફા (સ.) અને તેમના પવિત્ર ખાનદાના હવાલે કરી છે. આજે એ સ્થાન ઉપર અમારા અને આપના ઈમામ હજરત હુક્મત બીજી અલહસન અલ અસ્કરી અલયહિસ્સલામ બિરાજમાન છે.

السَّلَامُ عَلَيْكَ يَا بَابَ اللَّهِ وَدَيْنَهُ

“સલામ થાય આપ ઉપર એ ખુદાના દરવાજા, તેના દીનના દાકીમ.”

આ વાક્ય પણ પાછળના વક્યની જેમ બે ખૂબીઓથી ભરપુર છે. એક દરવાજો અલ્લાહ છે જે બીજી જીયારતોમાં પણ છે. રિવાયતોમાં રસૂલ સ.ની અહુલેભયતને અલ્લાહના દરવાજાના લકબથી યાદ કરવામાં આવ્યા છે. જેમકે ઈમામ સાદિક (અ.) ફરમાવે છે :

الْأَوْصِيَاُؤُهُمْ أَبْرَأُبُ اللَّهِ الَّتِي يُوْتَى مِنْهَا وَلَوْلَاهُمْ مَا عَرَفَ اللَّهُ عَزَّ وَ جَلَّ وَ بِهِمْ احْتَجَ اللَّهُ تَبَارَكَ وَ تَعَالَى عَلَى حَلْقِهِ

(તફસીરે બુરહાન ભા. ૧ પા. ૧૯૦)

પચગમ્બર (સ.)ના વારસદારો જ અલ્લાહના દરવાજા છે, જેમના થકી હક તથાલાની બારગાઈ સુધી પહોંચી શકાય છે. જો આ હજરતો ન હતે તો ખુદાએ અગ્ર વ જલને કદાપી ઓળખી ન શકાત. તેઓના દ્વારા અલ્લાહ તથારક વ તથાલાએ પોતાની હુક્કત લોકો પર પૂરી કરે. હજરત ઈમામ બાકીર (અ.) ફરમાવે છે :

“અમે છીએ અલ્લાહની હુક્કત અને (અમે છીએ) અલ્લાહના દરવાજા.” (તફસીરે બુરહાન ભા. ૧ પા. ૧૯૦)

દોઆએ નુદબા (જે ખુદ ઈમામે અસ (અ.)ને સંબોધિત છે) માં હજરત (અજ)ને આ રીતે સંબોધન કરીએ છીએ :

أَئِنْ كَابُّ اللَّهُ الْدِي مِنْهُ يُوتَى

“કૃયાં છે તે ખુદાનો દરવાજો જેના મારફતે ખુદા સુધી પહોંચી શકાય છે ?”

અલ્લાહના દરવાજાનો શું અર્થ છે ? આ લખાણના કારણે એવી શંકા કે ગેરસમજ ન થાય કે અલ્લાહ કોઈ સ્થળ અથવા મકાનમાં રહે છે અને તેનો દરવાજો અહુલેબ્યત (અ.) છે. આ બાબતને સ્પષ્ટ કરવા માટે અમે દરવાજાના થોડા ગુણધર્મો લખીએ તે યોગ્ય ગણાશે. કોઈપણ ઘર કે બગીચાના દરવાજાની કટ્ટણના કરીએ. આ દરવાજાનું શું કામ છે ? દરવાજાનો સૌથી પહેલો લાભ એ થાય છે કે એજ સાચો માર્ગ છે કે જેના દ્વારા ઘર કે બગીચામાં પગ મુકવામાં આવે છે. જો કોઈ માણસ દરવાજો છોડીને દિવાલ કૂદીને ઘર અથવા બગીચામાં દાખલ થાય તો તે માર્ગ ખોટો અને અયોગ્ય ગણાશે. બુદ્ધિ અને શરીરાત બને તેને વખોડે છે.

અહુલે સુશ્રતના મશહૂર તફસીરકાર હાફીજ જલાલુદ્દીન સુયુતી નકલ કરે છે કે એક વખત ઉમર બીન ખતાબ તેમના ખીલાફતના સમયગાળામાં રાત્રે ફરી રહ્યા હતા. આપને એક ઘરમાંથી કંઈક અવાજો સંભળાયા. અને આપ શકમાં પડી ગયા. આપ દિવાલ ઉપર ચઢીને અંદર ઘુસી ગયા. આપે જોયું કે એક માણસ એક સ્વીની સાથે બેસીને શરાબ પીવામાં મસ્ત છે. આપે કહ્યું, “એ ખુદાના દુશ્મન ! શું તું એમ માને છે કે તું ખુદાથી છુપાએલો છે જ્યારે તું આ નાફરમાની કરી રહ્યો છે ?” તેણે જવાબ આયો : એ અમીરુલ મોઅમેનીન ! ઉતાવળા ન થાવ. જો મેં એક બુલ કરી છે તો આપે ત્રાણ ગુનાહોને આચર્યા છે. ખુદાવદે મોતાલ ફરમાવે છે : જાસુસી ન કરો. અને આપે જાસુસી કરી. ખુદાવદે મોતાલ ફરમાવે છે : “ઘરોમાં તેના દરવાજામાંથી દાખલ થાયો.” આપ દિવાલ કૂદીને આવ્યા છો. અલ્લાહનો હુકમ છે કે ઘરમાં દાખલ થતાં પહેલાં સલામ કરો. આપે સલામ ન કરી...” (તફસીરે દુરૂહ મનસુર ભા દ પા. ૮૩)

તેથી માણસ જ્યારે કોઈ ઘર, બાગ કે શહેરમાં દાખલ થવા માંગે ત્યારે યોગ્ય એ છે કે તે બીજે ક્યાંયથી નહિ પરંતુ દરવાજેથી દાખલ થાય.

બીજું શિર્ષક-ખુદી “દર્યાને દીન” હતું. “દર્યાન” નો અર્થ શું થાય છે અને ઈમામે અસ્ટ (અ.)ને “દર્યાન” ના નામથી શા માટે યાદ કરવામાં આવે છે ? મરહુમ તોરયાહી લખે છે : “દર્યાન, ખુદાવદે તથાલાના નામો પૈકી એક નામ છે. તેનો અર્થ છે કે હદ્દાર, (સપ્તી કરનાર) હાકીમ અને કાજી.” રસૂલે અકરમ (સ.) ની પ્રસંગાને ગુણોમાં કહે છે : “યા સચ્યદમાસે વ દર્યાનલ અરબે” અને હદીસોમાં છે કે :

“કાન અલીયુન દર્યાન હાજેલીદુર્મતે બઅદ નબીયેહા”

“અલી (અ.) પચગમ્બર (સ.)ની પછી આ ઉમ્મતના દર્યાન અને હાકીમ હતા.” (મજમુલ બહરયન ભા. ૬ પા. ૨૫૩ અકરખુલ મવારીદ) દેખીતી રીતે જ રસૂલે અકરમ (સ.)ના સમગ્ર ખાનદાનમાં આ ગુણ સમાયેલો છે. (જેવી રીતે બીજી ઝીયારતોમાં પણ છે) અને આજે આ ગુણ જાહેર થવાનું સ્થાન અલ્લાહના નુર ઈમામ અસ્ટ (અજ) છે.

السَّلَامُ عَلَيْكَ يَا حَلِيلَةَ اللَّهِ وَ نَاصِرَ حَقِّهِ (ﷺ)

“સલામ થાય આપ પર એ અલ્લાહના વારસદાર અને તેના હકના હિમાયતી અને મદદગાર.”

આ વાક્યમાં પણ બે ગુણો છે. અરબી ડીક્ષનરીમાં ખલીફાનો અર્થ આ રીતે કરવામાં આવ્યો છે :

(ખલીફા અર્થાત) “જે કોઈ બીજાનો વારસદાર હોય અને તેનું હુંમેશાનું સ્થાન હોય. આજ કારણે કોઈ મોટા બાદશાહને ખલીફા કહે છે.”

શરીરાતમાં ખલીફાનો અર્થ છે ઈમામ. તેનાથી વધુ ઉંચા કોઈ ઈમામ ન હોય. તેથી આજના સમયમાં ઈમામે જમાના (અ.) બિલાફિતના આ બુલન્દ અને ઉચ્ચતર સ્થાન ઉપર બિરાજમાન છે. આપ તે સૌથી મહાન સુલ્તાન છે કે આપની સલ્તનતની સામે બધી સલ્તનતો અને હુકુમતો, ત્યાં સુધી કે દાઉદી મુલ્ક અને સુલયમાની હુકુમત પણ હુલકી છે. આપ એ પેશવા છે કે આપથી વધીને બીજા કોઈ માગદર્શક કે પેશવા નથી. આ અનુસંધાનમાં એક હુદીસ રજૂ કરીએ છીએ :

“મહદી (અ.) એવી સ્થિતિમાં જુહુર ફરમાવશે જ્યારે આપના માથા ઉપર વાદળ છાંચો કરતો હશે. તેમાં એક મુનાદી પોકાર કરી રહ્યો હશે. આ મહદી (અ.) ખુદાના ખલીફા છે તેમનું અનુસરા કરો.” (અલ બયાન ફી અખ્બારે સાહેબુગુરુમાન (અ.) સંપાદન હાફીજ મોહમ્મદ બીન યુસુફ ગાન્જી શાફી મ. ૧૫)

વ નાસેર હક્કેહી

આ વાક્યમાં આ બીજી સલામ છે. જો કે ખુદાના બધા વલીઓ આ સ્થાન ધરાવતા હતા, પરંતુ ઈમામે જમાના (અ.) માટે આ પવિત્ર સ્થાન ખાસ ઉચ્ચ સ્થાન ધરાવે છે, કારણ કે આપને હકની અને દીનની મદદ માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ વાક્યને વધુ સ્પષ્ટ કરવા માટે “હક્કેહી”થી શું મતલાભ છે તે સમજી લઈએ. ઈમામ (અજ.) અલ્લાહના હકના મદદગાર છે. હવે અલ્લાહનો હક શું છે ? યોથા ઈમામ હજરત ઈમામ જયનુલ આબેદીન (અ.)

રિસાલત અલ-હુક્કની શરૂઆતમાં ફરમાવે છે.

“ખુદાવદે મોતાલનો સૌથી મોટો હક તમારા ઉપર એ છે કે તમે (માત્ર) તેની ઈબાદત કરો અને બીજા કોઈને તેના ભાગીદાર ન બનાવો.” (કિતાબુલ ખેસાલ પા. ૫૬૬)

આથી જાણવા મળે છે કે ખુદાનો હક તૌઠીએ છે. એટલે તેની ઈબાદત કરો અને કોઈને તેના શરીક-ભાગીદાર ન બનાવો. જેમકે અગાઉ લખી ચૂક્યા છીએ કે બધા નભીઓ અને વલીઓ આ સ્થાન ધરાવતા હતા. પરંતુ કોઈપણ નભી અથવા પયગમ્બરે તેમાં સંપૂર્ણ અને યકીની સફળતા ગ્રામ નથી કરી. તે ઉપરાંત કુરાને કરીમમાં તેઓની કોમ વિશે છે :

وَمَا آمَنَ مَعَهُ إِلَّا قَلِيلٌ

અર્થાતઃ : “ઘણાજ ઓછા લોકો આપ ઉપર ઈમાન લાવ્યા. પરંતુ ઈમાન અસ (અજ.) ના જુહુરની આગાહી કરતા અલ્લાહ ફરમાવે છે :

يَعْبُدُونَنِي لَا يُشْرِكُونَ بِي شَيْئًا

(સુરા નુર આ. ૫૫)

અર્થાતઃ : તે લોકો માત્ર મારીજ ઈબાદત કરશે અને કોઈને પણ મારો શરીક નહીં બનાવશે. આ નુસરત અને મદદમાં, ખુદ અલ્લાહ તથાલા આપની મદદ કરશે. જેવી રીતે અમુક રિવાયતોમાં છે કે અલ્લાહ ફરિશતાઓ થકી આપની મદદ કરશે.

દોયા ઈફતોતાહમાં આ અર્થનો તરજુમો મઅસુમ (અ.) ના સ્વમુખે જોઈએ.

اللَّهُمَّ أَعْزَزْ بِهِ وَأَغْرِيْ بِهِ وَأَنْصُرْ بِهِ وَأَنْتَصِرْ بِهِ وَأَنْصُرْ نَصْرًا  
عَرِيزًا وَافْتَحْ لَهُ فَتْحًا يَسِيرًا وَاجْعَلْ لَهُ مِنْ لَذْنُكَ سُلْطَانًا نَصِيرًا

(મફાતીહુલ જ્ઞાન, ઈકબાલુલ અયમાલ - સંપાદક -  
સચ્યદ બીન તાઉસ રહ. ભા. ૧ પા. ૧૪૨)

“ખુદાયા ! તેઓને ઈજુત દે અને તેઓના થકી અમને પણ ઈજુત દે. તેઓની મદદ કર અને તેઓ થકી અમારો પણ બદલો દે. તેઓને સર્વશ્રેષ્ઠ મદદ આપ અને તેઓના વિજયને આસાન કરી દે. તારી પાસેથી તેઓને શક્તિ આપ જેનો તું મદદ કરનાર હો.”

(તરજુમો - મરહુમ અલ્લાહ સૈયદ જીશાન હૃયદર જવાદી)

السَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللَّهِ وَ دَلِيلَ إِرَادَتِهِ

સલામ થાય આપ ઉપર એ અલ્લાહની હુક્કત અને તેના ઈરાદાઓની તરફ માર્ગદર્શન કરનાર.

ઈમામે જમાના (અ.) નું પવિત્ર અસ્તિત્વ અલ્લાહ તથાલાની સર્વશ્રેષ્ઠ હુક્કત (દલીલ) છે. ખુદાવદે મોતાલ આપના થકી લોકો ઉપર પોતાની હુક્કત પૂરી કરશે. લોકો ઈમામ (અ.) દ્વારા અલ્લાહની હુક્કતને જાહેર રીતે જોશે. બીજા શબ્દોમાં જો કોઈ ઈમામ અસર (અ.) ના વસીલાથી હક તથાલા સુધી નહિ પહોંચી શકે તો તેના

માટે ખરેખર અશક્ય છે કે તે સાચી ઓળખ મેળવી શકે. જનાબ હુકીમા ખાતુન (રહ.), ઈમામ જવાદ (અ.) ના પુત્રી ફરમાવે છે કે જેવો ઈમામે જમાના (અ.) એ આ દુનિયામાં પગ મુક્યો કે તરતજ આપ સજદામાં તશરીફ લઈ ગયા. આપના બાવળા ઉપર નૂરના પ્રકાશથી લખેલું હતું :

حَاءُ الْحُقُّ وَ زَهْقُ الْبَاطِلُ

“હક આવી ગયો અને બાતીલ નાશ પામ્યું.” મેં આપને ખોળામાં લીધા અને આપના સન્માનીય પિતા હજરત ઈમામ અસ્કરી (અ.) ની પાસે લાવી. ઈમામ અસ્કરી (અ.) એ પિતાના વાતસલ્ય ભર્યો હુથ આપના માથા ઉપર ફેરવ્યો અને કહ્યું :

“કલામ કરો એ અલ્લાહની હુક્કત ! એ પયગમ્બરોના બાકી રહેલા વારસદાર ! એ અલ્લાહના વસીઓમાંના અંતિમ વસી ! એ બે-પનાહ ચમકતી સફેદીને ઉડા દરિયામાં ફેરવી નાખનાર ! કલામ કરો (બોલો) એ પરહેજગારોના વારસદાર અને એ વસીઓના પ્રકાશ !”

જીવનની એ યાદગાર ક્ષાણોમાં જ્યારે પુત્ર પિતાને પાણી પીવારીવી રહ્યો છે અને વુઝુ કરાવી રહ્યો છે. જેરની અસરથી પિતાના કાળજાના કટકે કટક થઈ રહ્યા છે. પરંતુ કારણ કે ઈમામ છે તેથી અલ્લાહનો હુકમ આપવાની ચૂક નથી કરતા. ફરમાવે છે :

“એ પુત્ર ! હું તમને અલ્લાહનો હુકમ અને ખુશાખબરી આપું છું કે તમે સહેબુગ્ગામાન છો. મહદી (મવઉદ) છો અને અલ્લાહની દુનિયા ઉપર તમે તેની હુક્કત છો. તમે મારા પુત્ર અને મારા વારસદાર છો.” (ગયબત : શયખ તુસી : પા. ૧૬૫)

ડલીલ ઈરાદાદી

બીજી ખુબી જે આ વાક્યમાં કહેવામાં આવી છે તે છે ડલીલ ઈરાદાદી સલામ થાય આપ ઉપર એ અલ્લાહના ઈરાદાની તરફ માર્ગદર્શન આપનાર ! જુ હા, ઈમામે જમાના (અ.) નું વજુદ અને હેતુ ખુદાના ઈરાદાની દલીલ છે. ખુદાના ઈરાદાનો મતલબ સમજવા માટે એ જરૂરી છે કે આપણે ખુદાના ઈરાદાનો અર્થ સમજી લઈએ. ખુદાના ઈરાદાના બે પાસાઓ છે. એક અસ્તિત્વ અને સર્જનની સ્થિતિ અને બીજું શરીઅત અને હુકમોની સ્થિતિ છે. અસ્તિત્વ અને સર્જનની સ્થિતિમાં અલ્લાહનો ઈરાદો તેના સર્જનો છે. જેમકે આસમાન, જમીન, મલક, ફલક વિગેરે. આ ઈરાદાને અમલી કરવા માટે તે માત્ર “કુન” કહે છે અને તે વસ્તુ અને બનાવ અસ્તિત્વમાં આવી જાય છે. (ફયુન). જ્યારે શરીઅત અને હુકમોની સ્થિતિમાં ખુદાના અહુકામો અમૃ અને નહીં અંગેના છે. હુંવે જ્યારે આપણે આ ગુણ “દલીલ ઈરાદતેહી” ઉપર વિચાર કરીએ તો એ જાણવા મળે છે કે ઈમામે જમાના (અ.) આ બસે સ્થિતિમાં અલ્લાહના ઈરાદાની તરફ માર્ગદર્શન આપે છે. સર્જનની સ્થિતિમાં દરેક વસ્તુ ખુદાના ઈરાદાના સર્જનની તરફ દલીલ કરી રહી છે. પરંતુ આ બધી સ્થિતિમાં ખુદ ઈમામ (અ.) નું અસ્તિત્વ ખુદાએ મોતાલાના ઈરાદાની શ્રેષ્ઠ દલીલ છે. તેનું કારણ એ છે કે

અગર મોહમ્મદ અને આલો મોહમ્મદ (અ.સ.) ન હતે તો આસ્માન, જમીન, અર્શ, કુરસી, ફલક, મલક, જીવાત, ઇન્સાન વિગેરે કોઈને વજુદ્દનો લાભ ન મળતે. (એટલે કોઈ પણ મખ્લુક ન પેદા થતે.)

લવલાક લમા ખલકતુલખલાક

“એ પયગમ્બર ! જો આપ ન હતે તો હું દુનિયાનું સર્જન ન કરતે.”

إِنَّمَا خَلَقْتُ سَمَاءً مَبْنِيًّا وَلَا أَرْضًا مَدْجِيًّا وَلَا شَمْسًا مُضِيءًةً ...

إِلَّا لَجْلَجٌ وَمَجْجَةٌ هُوَ لَاءُ الْخَمْسَةِ الَّذِينَ هُمْ تَحْكَمُ الْكَسَاءُ

(હંડીસ કીસાઅ)

માત્ર એટલું જ નહીં બલ્કે ઈમામે અસ (અ.) એ વસીલા છે જેમના મારફતે પરવરદિગારે આલમ પોતાના ઈરાદા સર્જનો સુધી પહોંચાયે છે.

ઇમામ સાદિક (અ.) સચ્યદુશશોહુદાની જિયારતની તાલીમ આપતા ફરમાવે છે :

إِرَادَةُ الرَّبِّ فِي مَقَادِيرِ أُمُورِهِ تَهْبِطُ إِلَيْكُمْ وَتَصْدُرُ مِنْ يَوْمَكُمْ

“એ અહુલેબૈત (અ.) ! મુકદ્રાતે ઉમુરમાં (ઈરાદાઓના નિર્માણમાં) ખુદાનો ઈરાદો આપ ઉપર નાજીલ થાય છે અને આપના ઘરથી જ જાહેર થાય છે.”

(કુરુએ કાઝી કિતાબ અલ હજ-બાબ: જિયારતે કબે અભી અભુક્ષાહ અલ હુસ્યન (અ.) બાર, “મફકીહ” ઇમામ હુસ્યન (અ.)ની પહેલી જિયારત)

એક બીજી રિવાયતમાં ઇમામ અલી નકી (અ.) ફરમાવે છે :

“યદ્દિનથી ખુદાવદે મોતાલાલે મઅસુમ ઇમામોને પોતાના ઈરાદાઓના કાર્યકારીનું સ્થાન ગાળ્યું છે. પછી જ્યારે ખુદા કોઈ વસ્તુ ચાહે છે ત્યારે તે લોકો પણ તેને ચાહે છે. આજ છે તે આપતે કરીમાની તફસીર “અને તમે નથી ચાહતા પરંતુ જે અલ્લાહ ચાહે છે.” (બેહારુલ અન્વાર ભા. ૨૫, પા. ૩૭૨)

એક બીજી હંડીસમાં ઇમામ સાદિક (અ.) ફરમાવે છે :

“નેશક, ઇમામ ખુદાએ અજ્જ વ જલ્દના ઈરાદાનો માળો (સ્થળ) હોય છે.” (બેહારુલ અન્વાર ભા. ૨૫, પા. ૩૮૫)

હુવે રહી શરદ હુકમો અંગેની વાત. તો તેમાં ઇમામ (અજ) ખુદાવદે મોતાલાના હુકમો અને નિયમો તરફ શ્રેષ્ઠ દલીલ છે. બીજા શાખામાં દુનિયામાં કોઈ નથી કે જે ઈલાહી નિયમોને ઇમામ (અજ)થી વધુ સારી રીતે સમજી શકે અથવા ઇમામ (અજ)થી વધુ સારી રીતે તે પૂરા કરી શકે (અન્જામ આપી શકે). તેથી જો કોઈને જાણવું હોય કે ક્યા પ્રકારની ઈલાહીઓમાં અલ્લાહનો ઈરાદો સમાયેલો છે તો તે ઇમામ (અ.)ને જુઓ અને સંપૂર્ણતા: તેમનું અનુસરણ અને તાબેદારી કરે.

السلامُ عَلَيْكَ يَا تَالِيَ كِتَابُ اللَّهِ وَ تَرْجِمَانَهُ

“સલામ થાય આપ ઉપર એ અલ્લાહની કિતાબની તિલાવત કરનાર અને તેનું અર્થધટન કરનાર.”

આ વાક્યમાં પણ બે સલામ છે. પરંતુ અગાઉના વાક્યોમાં અને આમાં તફાવત એ છે કે આમાં બસે સલામો સમાન અને એક વિષય અંગે છે. અલ્લાહની કિતાબ કુરાનાને મળ્યા છે. બીજા શાખામાં આ વાક્યમાં બોલતું કુરાન અને એક ચૂપ કુરાન વરચેના સંબંધની વાત છે. આ બસે એક બીજાથી ક્યારે પણ જુદા નહીં પડશે. અને ક્યામતના દિવસે રસૂલ (સ.)ની સેવામાં એક સાથે પેશ થશે-હાજર થશે. આ વિષયની શ્રેષ્ઠ દલીલ હુદીસે સકલયન છે. જેમાં પયગમ્બર અકરમ (સ.)એ વસીયત કરી હતી :

“હું તમારા વચ્ચે બે મુલ્યવાન ચીજો છોડી જાઉ છું. એક અલ્લાહની કિતાબ અને બીજી મારી અહુલેબ્યત (અ.). આ બસે એકબીજાથી તે સમય સુધી જુદા નહિં પડે જ્યાં સુધી હવે કવસર પર મારી પાસે ન આવે.”

આ હંડીસ શીયા અને સુશી બસેની કિતાબોમાં ભરપૂર જોવા મળે છે. એ વાત બિલ્કુલ સ્પષ્ટ છે કે હાલના સમયમાં અહુલેબ્યત (અ.)નું પ્રતિનિધિત્વ ઈમામે અસ (અ.) કરી રહ્યા છે.

ઇમામ બાકીર અ. એ અમરુ બીજી અભીદને આ શાખામાં તાકીદ કરી :-

“એ અમર ! લોકોની ફરજ છે કે કુરાનને માત્ર એ રીતે જ પછે જે રીતે તે ઉત્ત્યુ છે અને જ્યારે તેમને તેની તફસીરની જરૂર પડે ત્યારે તેઓને જોઈએ કે અમારી પાસે આવે અને હિદાયત મેળવે.” (તફસીરે કુરાતે કુફી પા. ૮૧)

السلامُ عَلَيْكَ فِي اِنْتَاعٍ لَيْلَكَ وَأَطْرَافِ نَهَارَكَ

“સલામ થાય આપ ઉપર રાતના સમય ગાળામાં અને દિવસના અતરાફમાં.”

આ વાક્યનો સુર એવો છે કે આપણે દરેક સમયે દરેક ક્ષાળો હુઝરત (અ.)ને સલામ કરીએ છીએ. આ સલામનો ખુલાસો કુરાને કરીમની આ આયતમાંથી કરવામાં આવ્યો છે :

“અને રાતના સમયોમાં અને દિવસના અતરાફમાં તરબીહ કરો જેથી તમે રાજુ થાવ.” (“તા-હા” આ. ૧૩૦)

السلامُ عَلَيْكَ يَا بَقِيَّةَ اللَّهِ فِي أَرْضِهِ

“સલામ થાય આપ ઉપર એ જમીન ઉપર અલ્લાહની બાકી હુઝીત.”

સલામના આ વાક્યમાં હુઝરતના તે મશહૂર લક્ભનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી કુરાને કરીમે તેમની ઓળખ આપી છે.

“અલ્લાહના બાકી રહેલા તમારા માટે બહેતર છે, જો તમે ઈમાન ધરાવતા હો.” (સુરા હુદ : ૮૬)

ખરેખર તો ‘બકીયત’ શાખના અસંખ્ય અર્થો છે, પરંતુ અહીં ટૂંકાણ કરવા માટે સંતોષ ખાતર માત્ર એક અર્થની વાત કરીએ છીએ.

بَقِيَّةُ مِنْهُ : تُرِكَ بَعْضَهُ

અર્થાતઃ ઈમામ અસ્ક (અજ) અલ્ફાહ તગાલાના વલી, વસી અને હુજ્જતોનો સિલસિલો છે. તેની અંતિમ અને બાકી રહેલી કરી છે. આ અર્થ જ્યારોમાં પણ જોવા મળે છે.

السلام عليك يا بقيةَ مِنْ أُولِيَّاَهُ وَ حُجَّجِهِ

(કલે અકબર પા. ૭૧)

આ લકબ “બકીયતુલ્લાહ” નો ભૂતકાળના ઈમામો (અ.) માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ ખાસ રીતે તેનો ઉપયોગ ઈમામે જમાના (અ.)ના માટે કરવામાં આવ્યો છે. નીચેની હંડીસથી સ્પષ્ટ થાય છે કે એક કુરાનને નકારનારે અમીરુલ મોઅમેનીન અલી (અ.)ને સવાલ કર્યો કે મેં કુરાનમાં આ આયતને જોઈ છે કે “બકીયતુલ્લાહ તમારા માટે બેહતર છે.” આ કઈ બાકી રહેનાર વસ્તુ છે ? ઈમામ (અ.) એ જવાબ આપ્યો, તેનો અર્થ ઈમામ મહદી (અ.) છે તેઓ કસોટી કાળમાં જાહેર થશે. પછી દુનિયાને એ રીતે અછલ અને ઈન્સાફથી ભરી દેશે જે રીતે તે ઝુદ્ધ અને અત્યાચારથી ભરી હશે. તેમની નિશાનીઓમાં ગયબત અને છુપાઓલ રહેવું છે. જ્યારે શયતાનીયત ફેલાઈ જશે અને બદલાની આગ ભડકી ઉઠી હશે. (બેહતુલ અન્વાર ભા. ૮૩, પા. ૧૧૮)

જ્યારે ઈમામ હુસન અસ્કરી (અ.) એ અહુમદ બીન ઈસ્હાક કુમ્મી (જે આપના અત્યંત વિશવસનીય સાથીદાર હતા) ની પોતાના પુત્ર ઈમામ જમાના (અ.) સાથે ઓળખાગું કરાવી, (તે સમયે જ્યારે ઈમામ બાળ-વયના હતા) ઈમામે જમાના (અ.) એ અહુમદને ફરમાયું :

“હું અલ્ફાહનો બાકી પ્રતિનિધિ છું, તેની જમીન ઉપર.” (કમાલુદીન પા. ૩૮૪) આ જ જાહેરાત આપ (અ.) ઝુહુર થયા પછી પણ કરશે. ખાનએ કાબા ઉપર ટેકો દેશે. કવિએ તે આ રીતે કહ્યું છે :

بِقِيَةِ اللَّهِ وَ صَفْوَةِ الرُّسُلِ وَ نُخْبَةُ الْوُجُودِ مَا شَيْكَتْ فَقُلْ

السَّلَامُ عَلَيْكَ يَا مِيشَاقَ اللَّهِ الَّذِي أَحَدَهُ وَ وَكَدَهُ (ف્લો)

“સલામ થાય આપ ઉપર એ અલ્ફાહના વાયદા અને વચ્ચન, જે રીતે ખુદાએ (બંદાઓ) પાસેથી લીધા છે અને તેની તાકીદ કરી છે.”

“મિસાક” એટલે અહુદ (વાયદો અને વચ્ચન). વિશાસપાત્ર હંડીસોમાં જોવા મળે છે કે ખુદાએ શીયાઓ પાસે રૂહોની દુનિયામાં મહાસુમ ઈમામો (અ.)ની વિલાયતનો વાયદો અને વચ્ચન લીધા. આ વાક્યમાં આપણે ઈમામ અસ્ક (અ.)ને મિસાકલ્લાહ (અલ્ફાહનો કોલ અને કરાર)ના લકબથી સલામ કરીએ છીએ. આપ એ કોલ-કરાર અને વચ્ચન છે જે લેવામાં આવ્યું છે અને તેની તાકીદ કરવામાં આવી છે. રૂહોની દુનિયામાં જ્યારે બધા ઈન્સાનોને અલ્ફાહની બારગાહમાં રજકણોના સ્વરૂપે રજુ કરવામાં આવ્યા અને તેઓ પાસે ખુદાની ખુદાઈ, પયગમ્બર (સ.)ની રિસાલત અને અમીરુલ મોઅમેનીન (અ.)ની વિલાયત અંગે સવાલો કરવામાં આવ્યા તો સૌથે સ્વિકાર કર્યો. પરંતુ જ્યારે કસોટી અને પરીક્ષાનો

પ્રશ્ન આવ્યો ત્યારે મોટા ભાગના નિઝ્ફળ ગયા અને માત્ર થોડી વ્યક્તિઓએ સફળતા પ્રાપ્ત કરી. આ ત્રાયેય વચ્ચનો પછી ખુદાએ લોકોને ઈમામે જમાના (અ.)ની ગયબત અને ઝુહુર વિષે સવાલ કર્યો તો તેમાંથી પણ થોડી વ્યક્તિ સફળ થઈ. આ જ તે વચ્ચન છે જેના માટે તાકીદ કરવામાં આવી છે. આ જ તે વાયદો અને વચ્ચન હતું જે ઉલુલ અઝમ પયગમ્બરોની વિલાયતનું કારણ બન્યું. ઈમામ બાકીર (અ.) ફરમાવે છે :

“ખુદાવદે મોતાલાદે ઉલુલ અઝમ પયગમ્બરો પાસે આ વચ્ચન લીધું : હું તમારો પરવરદિગાર છું. મોહમ્મદ (સ.) મારા રસૂલ છે. અલી (અ.) અને તેમના વારસદારો મારા અભ્રના વાલીઓ અને મારા અભ્રના ખજાનેદાર છે. યકીનથી મહદી (અ.) થકી હું મારા દીનની મદદ કરીશ અને મારી હુકુમતને જાહેર કરીશ. તેમના થકી મારા ફુશમનો સામે બદલો લઈશ અને તેમના થકી દરેક દરેક મારી ઈબાદત કરશે પછી તેઓને પસંદ હોય કે ન હોય.” (ઉસુલે કાફી ભા. ૨, પા. ૮, ગ. ૩, હ-૧)

“જ હા.” દરેક ઉલુલ અઝમ પયગમ્બરે આ વાતનો રૂહોની દુનિયામાં સ્વિકાર કર્યો કે મહદી (અ.) થકી ખુદાના દીનની મદદ કરવામાં આવશે.

السَّلَامُ عَلَيْكَ يَا وَعْدَ اللَّهِ الَّذِي ضَمِّنَهُ (x)

“સલામ થાય આપ ઉપર એ ખુદાના વાયદા, જે ની જામીનગીરી ખુદ ખુદાએ લીધી છે.”

કેટલીય દોઆઓ અને જીયારતોમાં ઈમામે જમાના (અ.)ને મવઉદના નામથી યાદ કરવામાં આવ્યા છે. પરંતુ જ્યારતે આલે યાસીનની વિશેષતાઓમાંની એક વિશેષતા એ છે કે તેમાં ઈમામે જમાના (અ.)ને “વઅદુલ્લાહ” ના નામથી યાદ કરવામાં આવ્યા, એટલું જ નહિ બલ્કે તે વાયદો કે જેની જામીનગીરી ખુદ ખુદાની જાતે લીધી છે. કદાચ “વાયદો” શાબ્દ એટલા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે કે ઈમામે અસ્ક (અ.) પોતાની મવઉદીયત (‘મવઉદ’ : જે નો વાયદો કરવામાં આવ્યો હોય તે)ની અતિશયતાના કારણે પોતે વાયદો કહેવાવવા લાગ્યા. એટલે સુધી કે જ્યારે પણ અલ્ફાહનો વાયદો શાબ્દ આવે છે ત્યારે તેનો પર્યાય માત્ર અને માત્ર ઈમામે અસ્ક (અ.) છે. ઉદાહરણ રૂપે સુરા મરયમની આયત ૮૫)

“જ્યારે તેઓ જોશો કે તેઓની સાથે કઈ વસ્તુનો વાયદો કરવામાં આવ્યો છે.”

તેની તફસીરમાં ઈમામ સાદિક અ. ફરમાવે છે :

“અહિ વાયદાનો અર્થ હજરત મહદી (અ.)નું જાહેર થવું છે.” (ઉસુલે કાફી ભા. ૧ પા. ૨૩૧, હ-૮)

આવી જ રીતે સુરા નુરની આયત પદમાં અહેમ વાત એ છે કે અલ્ફાહ વાયદાની વિરુદ્ધ ક્યારે પણ નહિ કરે. વારંવર તેણે આ વાતની તાકીદ કરી છે.

“અલ્ફાહ પોતાનો વાયદો ક્યારે પણ તોડશે નહિ.” (આલે

(અનુસંધાન ૧૦માં પાના ૫૮)

# જો ખુદાની હુજ્ઞત ન હોય....?

આપણા બધા અકીદાઓને પાયો અક્કલ અને શરીરાત છે. અક્કલ અને શરીરાતનો ફેંસલો છે કે જગતના સંચાલન અને કારભારના માટે એક ‘સંપૂર્ણ ઈન્સાન’, ‘ખુદાની હુજ્ઞત’, ‘અક્કલથી કામ લેનારો’, ‘અક્કલથી કામ કરનારા’નું અસ્તિત્વ હોવું જરૂરી છે. જેનું અસ્તિત્વ આ સમગ્ર જગતના અસ્તિત્વ ઉપર છવાએલું હોય તે આ જગતનો હાકીમ હોય અને હુકમ આપનાર હોય. તેનું અસ્તિત્વ બધા લોકોથી પ્રતિષ્ઠિત અને જુદ્દો હોય. તેને બધા અસ્તિત્વો ઉપર શ્રેષ્ઠતા અને મહાનતા ગ્રામ હોય. જો તેનું અસ્તિત્વ ન હોય તો આ જગતનું અસ્તિત્વ અને તેનું બાકી રહેવું મુશ્કેલ-અશક્ય છે.

ખુદાવદે આલમ તરફથી આ જગતને જે કાઈપણ લાભ મળી રહ્યો છે : જ્ઞાન, જીવન, શક્તિ, રહુમત.. બધું તેના કારણે છે. એક ઉદાહરણ આપી આ વાતને સ્પષ્ટ કરીએ છીએ.

સૂર્યના પ્રકાશથી સમગ્ર જગત પ્રકાશિત અને ઉજ્જવળ છે. જમીન, ઘર, પહુંચ, દરિયો... સમગ્ર વાતાવરણ આ સૂરજના કારણે પ્રકાશિત અને ઉજ્જવળ છે. દરેક જગ્યાએ તેનો પ્રકાશ ફેલાએલો છે. તેમાંની અમૃત વસ્તુઓ એવી છે જેનું અંતર સૂરજથી ઘણું ઓછું છે અને તે તેની ઘણી નજદિક છે અને અમૃત વસ્તુઓ એવી છે જે સૂરજથી ઘણી વધારે દૂર છે. ત્યાં જે અજવાણું જોવા મળે છે તે આજ સૂરજનું અજવાણું છે. તેની કિરણો અને તાપની અસર છે. શું તેમ બની શકે છે કે સૌથી વધુ દૂર જગ્યા સૂરજના પ્રકાશથી ઉજ્જવળ હોય અને સૌથી નજદિક જગ્યા અંધારી હોય ? શું એ પણ થઈ શકે કે સૂરજનો પ્રકાશ પહેલાં સૌથી દૂરના કેન્દ્રને પ્રકાશિત અને ઉજ્જવળ કરે અને સૌથી નજદિકની જગ્યા સુધી ન પહુંચે. અક્કલ આ વાતનો સ્વિકાર નથી કરતી. અક્કલથી તે અશક્ય છે. જ્યારે સંપૂર્ણ પ્રકાશ સૂરજથી મળી રહ્યો છે અને દરેક તેના કારણે પ્રકાશિત અને ઉજ્જવળ છે તો સૌથી પહેલાં તે વસ્તુને પ્રકાશિત થયું જોઈએ જે સૌથી વધુ નજદિક હોય, અને સૌથી વધુ દૂરની જગ્યાઓને પછીથી પ્રકાશિત થયું જોઈએ. બલ્કે આ પ્રકાશ સૌથી વધુ નજદિકની જગ્યાએથી ઘીરે ઘીરે સૌથી વધુ દૂરની જગ્યા સુધી પહુંચેશો અને તબક્કાવાર વસ્તુઓ પ્રકાશિત અને ઉજ્જવળ થતી જશે. આ પ્રકાશ એક સ્થળેથી થઈને બીજા સ્થળ ઉપર પહુંચેશે. જે વસ્તુ કેન્દ્રની વધુ નજદિક હશે તે સૌથી વધારે પ્રકાશિત હશે. તેમાં પ્રકાશની વિશેષતાઓ સૌથી વધુ હશે. તે કેન્દ્ર સંપૂર્ણ વિશેષતાઓનો સમૂહ હશે. ફરક માત્ર એટલો છે કે આ છે તો કેન્દ્રની તમામ વિશેષતાઓનો સંગ્રહ અને દરેક સુધી પ્રકાશ તેમાં થઈને પહુંચેશે. પરંતુ આ પ્રકાશ તેનો પોતાનો નથી. બધું આ કેન્દ્રની મહેરબાનીથી છે. બધું આ કેન્દ્રના કારણે છે.

આવી જ રીતે આખી દુનિયાને પ્રકાશિત કરનાર સૂર્ય, દિવ્યતા અને ખુદાઈથી જીવનનો પ્રકાશ, ઈદમનો પ્રકાશ, સહિતનતની શક્તિ, પ્રતિજ્ઞા વિગેરે. ... ટૂંકમાં બધી વિશિષ્ટતાઓના સિલસિલાના લાભથી બધા સંભવિત પદાર્થો અને સર્જનોને પ્રકાશિત કરી રહ્યો છે. બધી ખૂબીઓના લાભનો સિલસિલો બધા સંભવિત પદાર્થો અને સર્જનોને પ્રકાશિત કરી રહ્યો છે. દરેકની હુકીકત આ જ ઈલાહી નુરથી પ્રકાશિત થઈ રહી છે. જેની પાસે જે પણ ખૂબીઓનો કમ છે તે બધો આજ ઈલાહી નુરની મદદ છે. જ્યારે આ નુર અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે હસ્તી જેનો દરજ્ઝો સૌથી વધુ ઉચ્ચો છે, જે પાક પરવરદિગારની ભારગાહથી સૌથી વધુ નજદિક છે, તે નુરે સૌથી પહેલાં તેને પ્રકાશિત કર્યા. અખાહના નુરની સૌથી વધુ ઉજ્જવળતાઓ આ જ હસ્તીમાં પ્રકાશિત થઈ. પછી તેમાંથી થઈને આ કમ બીજા સુધી પહુંચ્યો. જો આ ન હોતું તો બીજા સુધી આ સિલસિલો ન પહુંચ્યે. આ કારણે જેને જે કાંઈપણ મળી રહ્યું છે તે તેનાજ “વાસ્તા”થી મળી રહ્યું છે.

## સર્જનોનો કમ :

સર્જનના દરજ્ઝા મુજબ માનવી માણણી કરતાં ઉચ્ચ્યતર છે. આ પ્રભાવ અને દરજ્ઝાની ઉચ્યતા માત્ર સર્જનના કારણે જ નથી બલ્કે તે વિશેષતા અને ખૂબીઓના કારણે છે. જે એક સર્જનમાં છે, બીજામાં નથી. માનવી અક્કલ અને સમજશક્તિના કારણે ઉચ્યો છે. પ્રાણીઓ લાગણીના કારણે વનસ્પતિથી જુદા છે. એટલે કે સર્જનો પોતાની ખૂબીઓના કારણે એકબીજા ઉપર ઉચ્યતા અને શ્રેષ્ઠતા ધરાવે છે. અખાહની ભલાઈથી સૌ પ્રથમ માનવી લાભ મેળવશે. તેથી તે ખૂબીઓ સૌથી ઉચ્ચ દરજ્ઝા ઉપર રહેલી છે. તે પછી પ્રાણી, પછી વનસ્પતિ અને પછી નિર્જવ પદાર્થો.

## “હુજ્ઞતે ખુદા” સૌથી વધુ ઉચ્યતર :

જેવી રીતે સર્જનોમાં એકને બીજા ઉપર વિશેષતા અને અગ્રતા મળેલી છે તેવી જ રીતે માનવીઓમાં ખૂબીઓના ધોરણે વિશેષતા અને અગ્રતા છે. તેથી ખુદાવદે આલમની કૃપા અને કમાલોથી સૌથી પહેલાં તે લાભ મેળવશે જે ખૂબીઓના ઉચ્ચ દરજ્ઝા ઉપર બિરાજમાન હશે. બીજા શબ્દોમાં જે વ્યક્તિમાં ઈલાહી ખૂબીઓ ભવ્ય, બુલંદ અને સૌથી ઉચ્યતર હોય દરેકને લાભ આજ વ્યક્તિના લીધે મળશે. આ પવિત્ર વ્યક્તિને રિવાયતોમાં હુજ્ઞતુલાહ કહેવામાં આવી છે. એક બાબત બિલ્કુલ અસંભવ છે કે સૌથી હુલ્કી વ્યક્તિ ખુદાની કૃપાનો લાભ ઉદાહીર રહ્યું હોય અને કોઈ ઉચ્ચ વ્યક્તિ મૌજુદ

(અનુસંધાન તરીક કવર પેજ ૫૨)

## (બીજા કવર પેજથી શરૂ)

ન હોય. તેથી દુનિયાનું અસ્તિત્વ એ કારણથી સંપૂર્ણ સ્પષ્ટ, પ્રકાશિત અને ખુલ્લી દલીલ છે. દુનિયાની ઉચ્ચ અને શરીરક વ્યક્તિ મોજુદ છે જેના “વાસ્ત્વ”થી દુનિયાની આ વ્યવસ્થા ટકી રહી છે. આ જ ઉચ્ચ અને સંપૂર્ણ વ્યક્તિની ઈલમી સુધારણાઓમાં “કુળવાન શક્તિ” અથવા “સંભવિત અધિકાર”થી ઓળખવામાં આવે છે.

આ સમયે આ પવિત્ર વ્યક્તિ હજરત હુક્કત ઈલ્મીલ-હસન અલ અસ્કરી (અરવાહોના ફીડા)નું પવિત્ર અસ્તિત્વ છે, જેના થકી આ દુનિયાનું અસ્તિત્વ છે અને ટકી રહી છે.

“આપના અસ્તિત્વના કારણે દુનિયા બાકી છે.

આપની બરકતથી દુનિયાને રોકી મળી રહી છે. અને

આપના અસ્તિત્વના કારણે જમીન અને આસમાન અખંડ અને સ્થાઈ છે.”

(દોઆએ અદીલા-મહાતી (ફારસી) પા. ૫૮)

દુનિયાના અણુએ અણુને ખુદાની કૃપાના લાભથી નવાજવામાં આવી રહ્યું હોય અને “સંપૂર્ણ ઈન્સાન”, “હુક્કતે ખુદા” મોજુદ ન હોય તે અસભંગ છે. કારણ કે અખાહના ફયુનો લાભ ખુદાની આજ હુક્કતને લીધે બધાને મળી રહ્યો છે. તેથી ખુદાની આ હુક્કત, બીજા સર્જનોની પહેલાં, સર્જનોની સાથે અને સર્જનોની પછી પણ મોજુદ છે. રિવાયતમાં છે :

الحجّة قبل الخلق و مع الخلق و بعد الخلق

“અગર હુક્કતે ખુદાન હોય તો આ કાયેનાત ફયુને ખુદાવંદીથી વંચિત રહેત.” (બેહારુલ અન્વાર ૨૩ પા. ૩૮ હ : ૬૬)

આ રિવાયત ઉપર જરા ધ્યાન આપીએ.

لو بقيت الأرض يوماً بلا إمام منا لساخت

“જો આ જમીન એક દિવસ પણ અહલેબ્યતના ઈમામની વગર રહી જાય તો ધસી પડે. નાશ થઈ જાય.” (બેહારુલ અન્વાર ૨૩ પા. ૩૭ હ : ૬૪)

આવી જ રીતે જો જમીન ઉપર એક માણસ પણ મોજુદ હોય તો તે વાતની દલીલ છે કે કોઈ ઈમામ જરૂર છે, જેના કારણે તે જીવતો છે. રિવાયતમાં છે : જો દુનિયામાં માત્ર બે માણસો રહી જાય તો તેમાંથી એક જરૂર ઈમામ હુશે.

### એહુસાનને ઓળખવો અને આભાર માનવો :

દરેક માણસની અક્કલ અને સ્વભાવ એ વાતની સાથી આપે છે કે જો કોઈએ એહુસાન કર્યો હોય તો હંમેશા તેના આભારિત રહેવું. આ એહુસાનની ઓળખ અને આભાર માનવો તે માત્ર માણસો પૂર્તું મર્યાદિત નથી, આ લાગણી જાનવરોમાં પણ જોવા મળે છે. જો જાનવરના માથા ઉપર પ્રેમથી હુથ ફેરવો તો તે તમારા તરફ આભારની લાગણીથી જોશે. તેની ખાસ ફબથી તમારો આદર કરશો. જો કોઈ પોતાના ઉપર એહુસાન કરનારાનો આભાર ન માને તો તે માણસ તો બાજુ ઉપર, જાનવરોથી પણ વધુ હલ્દકો છે.

ઉપરની દલીલોથી આ હુકીકત સ્પષ્ટ થઈ જાય છે. આ સમયે આખીદુનિયા અને તેના અણુએ અણુમાં પોતાનું અસ્તિત્વ, પોતાની રોજ, પોતાની બધી ખૂબીઓ અને ગ્રામ થાયેલ બધી અસંખ્ય નેઅમતોમાં, હજરત હુક્કત ઈલ્મીલ હસન અલ અસ્કરી ઈમામે જમાના, જમીન અને આસમાનના સ્તંભ, પૃથ્વીની ધરી, દુનિયાના જીવનના કેન્દ્રના, મોહતાજ છે. એક નાના બેવા જીવનની શરૂઆત કરવા માટે ખુદા માબાપનો આભાર માટે અને તેમની સાથે અનેક ગણી નેકી, અનુસરાણ અને તાબેદારીનો હુકમ આપ્યો છે. આપ અનુમાન કરી શકો છો કે જમાનાના ઈમામ અંગે આપણી જવાબદારી શું હુશે. આપણે બલ્કે આખા જગતે તેનાથી પણ વધીને કેટલા દરક્ષે જમાનાના ઈમામ અલયહિસ્સલામના એહુસાનમંડ તાબેદારી અને હુકમનું પાલન કરનાર હોવા જોઈએ. અને કેવી રીત તેમની સાથે એહુસાન અને નેકી કરવી જોઈએ.

મુખારક સુરા ઈખાહીમની સાતમી આયતમાં ઈરશાદ છે :

“તમારા પરવરદિગારનું આ સર્વસામાન્ય એલાન છે કે તમે નેઅમતોનો શુકર કર્યો તો હું જરૂર જરૂર તમારા માટે નેઅમતોમાં વધારો કરીશ અને જો નાશુકી કરી, કુફરને નેઅમતથી કામ લીધું તો પછી યકીનથી (ખરેખર) મારો અજ્ઞાબ સખત છે.”

જો આ જીવન અને તેને લગતી બધી ચીજો નેઅમત છે તો સૌથી મહાન નેઅમત તે ઉચ્ચી વ્યક્તિની છે જેના કારણે આ બધી નેઅમતો મળી રહી છે. હવે આ મહાન નેઅમતની સૌથી સારી શુકર કરવાની રીત શું છે ? જો આપણે સૌ ઈમામતની નેઅમતની કદર કરતે, સન્માન કરતે, બીજાને તેની ઉપર અગતા ન આપતે, તેમના હોવા પછી પણ બીજા પાસેથી દીન ન મેળવતે, તેમના કદ્યા મુજબ અમલ કરતે તો આજે જુહુરની નેઅમત ખુંચ્યવી લેવામાં ન આવતે. જમાનાના ઈમામની ગયબત આપણે કદર ન કરવાનું પરિણામ છે.

આજે પણ આપણે આપણા જમાનાના ઈમામને એ રીતે યાદ નથી કરતા જે રીતે કરવા જોઈએ. આ અકીદો અને તેની તાકીદને આપણા ઈમાની જીવનમાં એવી રીતે વણી લેવી જોઈએ જેવી રીતે લોહી નહિ બલ્કે જેવી રીતે રૂહ આપણા આખા શરીરમાં દોડી રહી હોય. સમગ્ર એહુસાસ બલ્કે જીવનનો સંપૂર્ણ આનંદ આ રૂહના લીધે હોય. ઈમાની જુંદ્ગાનો સમગ્ર આનંદ જમાનાના ઈમામના કારણે હોય. જો એહુસાસ નથી તો કાંઈપણ નથી. આવો ! આપણે સૌ સાથે મળીને આ ઈમાની એહુસાસને એવી રીતે મજબુત કરીએ, એવી રીતે જીવંત કરીએ કે જેથી આપણા જમાનાના ઈમામ અલયહિસ્સલામના જુહુરના માર્ગો તૈયાર થઈ જાય. અખાહની રેહમત જોશમાં આવે. દોઆ કબુલ થવાના બધા દરવાજાઓ ખુલ્લી જાય અને ખુદાના તરફથી દુમણા આ સમયે ઈમામના જુહુરનો હુકમ સાદર થઈ જાય.

بِيُونَه بَعِيدًا وَ نَرَاه قَرِيبًا

“તેઓ આ જુહુરને દુર સમજી રહ્યા છે અને અમે તેને નજદિક જોઈ રહ્યા છીએ.”

## ગૈબતમાં પઢવાની એક દોઆ

એ ખુદા એમની ગૈબતની લાંબી મુદ્દત અને એમના તરફથી છોઈ ખબર ન મળવાને  
લીધે અમારા યક્કીનને (શ્રદ્ધાને) આંચણી ન લેતો. એ ખુદા એમની યાદ, એમનો  
ઈતેઝાર, એમના પર જંપૂર્ણ-ઈમાન, એમના જુહુર પર ભરપૂર ભરોકો, એમના હજમાં  
દોઆ છરવા અને એમના પર દુકુદ અને જાલામ મોકલવામાં અમને છદાપી ગાંઝીલ ન  
કરતો. એમની લાંબી ગૈબત અમને એમના જુહુરથી નિવાશ ન છકે. એમના પધારવા  
પછી અમારું યક્કીન એવી જ કીતે બાઢી રહે જેવી કીતે તારા રક્ષાલ (એમના પર અને  
એમની આલ પર તારા દુકુદ અને જાલામ થાય)ની પદ્ધતામણી પર અમને ભરોકો છે.  
(મફાતીહુલ-જીનાન ઉર્દુ - પા. ૧૦૮૪)

જુમાના દિવસે અસ્તના વખતે આ દોઆ પઢવાની તાકીદ કરવામાં આવી છે.

શાખાનું મોઅગ્ગમ

હિજરી સન ૧૪૨૩

એ ખુદા આ ઓમતના ગમને ઈમામે ઝમાના (અ.સા.)ના જુહુર થકી દૂર કર અને અમારા માટે ઓમના જુહુરમાં જદ્દી કર. કારણ કે લિરોધીઓ જુહુરને દૂર કરી શક્યે છે અને અમે તેને પાસે જાલીએ હીએ.